


# શ્રી આત્માનંદ પ્રકાશ



શ્રી લૈન આત્માનંદ સભા  
અરગેટ, ગાવનગર - ૩૯૬૦૦૧

આત્મ સંવત : ૩૯/૩૯
વીર સંવત : ૨૪૫૭/૫૮
વિકાસ સંવત : ૧૯૮૭-૮૮
પુસ્તક : ૨૮

સાચે :



## વિષય-પરિચय.

૧ મંગલ પ્રાર્થના. ( પદ ) ...	... સં. વેલયંદ ધનજી. ...	...	૧
૨ જિનેન્દ્ર સ્તવ. ( પદ ) ...	... ન્યાયો મુનિ હિમાંશુનિભ્યજી. ...	...	૨
૩ નૂતન વર્ષનું મંગળનય વિવાન. ... ( સભા. ) ...	... ...	...	૪
૪ મનનું રહુસ્ય અને તેનું નિયંત્રણ. ( વિહૃબદ્ધસ મૃ૦ શાઠ ) ...	... ...	...	૧૪
૫ સંપાદકનું કર્તૃવ્ય. ...	... ( ગાંધી. ) ...	...	૧૯
૬ એક ઐતિહાસિક પત્ર. ...	... ( બોગીવાલ સંકેરણ. ) ...	...	૨૩
૭ સંસ્કારિત મન. ...	... ( દેસાઈ કસ્તુરયંદ હેમયંદ )	...	૨૫
૮ સ્વીકાર અને સમાલાયના. ...	... ... ...	...	૨૭

**પર્યુષણ પર્વમાં થતાં મહાવીર જન્મ મહોત્સવ માટે એક સગવડ.**

અમારા સાલગવામાં આંધ્રાં છે કે ડેઝાન્ડ ગામમાં ઘેરીઓ પારણા નહીં હોવાથી પર્યુષણ પર્વમાં મહાવીર જન્મ મહોત્સવ થતો નથી, તેથી તેતો પ્રચાર કરવા માટે આ સભાના એક આગેનાન સભાસદ તરફથી દ્રાપાના ઘેરીઓ પારણા શેડ ગિરથરલાલ આણાંહજી તથા શાંદ દામેદરહાસ ગોવીંદજીની દેખરેખ નીચે તૈયાર કરવી ને ગામના સંબન્ધે જરૂર હોય તેને અભુક્ત શરતે સગવડ કરી આપવામાં આવશે. માટે ઇન્દ્ર મળી ખુલાસો કરી જવો અને જરૂર જણાય તો પત્રભ્રવહાર આ સભાના સીરનામે કરવેલો.



## “ અમારું સાહિત્ય પ્રકારણ ખાતું. ”

નીચેના અંથો તૈયાર છે અને છપાય છે.

સંસ્કૃત અંથો. ( થોડા વળતમાં પ્રગટ થશે. )

- |                                  |  |
|----------------------------------|--|
| ૧ પુષ્ટકલ્યાંપ પીઠિકા.           | ૨ કર્મચંથચાર દેવેન્દ્રસૂર્યિકૃત ટીકા સાથે. |
| ૩ વિલાસવધુકહા. ( અમન્થ ભાવામાં ) |  |

### ગુજરાતી ભાષાંતરના અંથો.

- |  |       |
|--|-------|
| ૧ સુકૃતસાગર—પેથડકુમાર ચરિત્ર ( ધતિહાસિક અંથ ) તૈયાર છે.  | ૧-૦-૦ |
| ૨ ધર્મપરિક્ષા—ધર્મનું સ્વરૂપ કથાઓ સહિત. ( છપાય છે ).   |       |
| ૩ શ્રીપ્રભાવક ચરિત્ર—અનેક મહાન આચાર્યોથીના ધતિહાસિક દંધિએ જીવન વૃત્તાંત તૈયાર થાય છે.  |       |
| ૪ શ્રી મહાવીર ચરિત્ર—( ગ્રાચીન અંથ ઉપરથી. ) પ્રેસમાં છે.   |       |
| ૫ શ્રી સુરસુંદરી સતી ચરિત્ર—અતિ રસમય ચરિત્ર. ( લખાય છે ).  |       |
| ન. ૧ તૈયાર છે. બાકીના છપાય છે, બોગીના છે.  |       |
| ન. ૨ અને ન. ૪ માં આર્થિક સહાયની અધેક્ષા છે. સહાય આપનાર બંધુની ધર્મજી પ્રમાણે સહિન્યય કરવામાં આવશે. આ સભા તરફથી પ્રગટ થતાં દરેક અંથના કાગળો, ટાઇપો, બાઈટીંગ એ તમામ ઉંચા પ્રકારના થતાં હોવાથી દરેક અંથની સુંદરતા માટે લાઇઝ મેમરે અને વીજીટરો વગેરે બંધુઓએ સંતોષ બતાવેલ છે. |       |

ભાવનગર ધી “આનંદ” પ્રિન્ટિંગ પ્રેસમાં-શાહુ ગુલામચંદ લલલુલાલાંએ છાયે.

આજના અંકનો વિધરે.

# શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર

તરફથી

પ્રકટ થયેલ ગ્રંથોનું

(નેમાં સંસ્કૃત, માગધી, ગુજરાતી ભાષાના તથા જૈન  
ઐતિહાસિક વિગેરે છે.)

## બ્રૂધ્યોપત્ર.



આત્મ સંવત ૩૩

દીર સંવત ૨૪૫૫

વીડેમ સંવત ૧૯૮૫

સને ૧૯૮૮

શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર.

## ( संस्कृत मागधी अने भूग टीकाना अंशोः )

+१ श्री भमवसरथु रतनः ...	०-१-०	२५ चेतोद्वालम् ...	०-४-०
+२ क्षुब्धक भयावलि प्रकरण्युम् ...	०-१-०	+२६ श्री पर्युपल्लि पर्वाष्ठानिकां	०-६-०
+३ श्री लोडनालिकानिशिका ...	०-२-०	व्याप्त्यानम् ...	०-६-०
+४ श्री योनिस्तवः ...	०-१-०	+२७ चंपेकमाला कथा ...	०-६-०
+५ श्री कालसमतिशालिखान प्रकरण्युम् ०-१-६		+२८ सम्यक्षत्वं द्वैमुदी ...	०-१२-०
+६ हेष रिथित रतनः ...	०-१-०	+२९ श्राद्ध गुणविवरण्युम् ...	१-०-०
+७ श्री सिद्धहंडिका ...	०-१-०	+३० धम रतन प्रकरण्युम् ...	०-१२-०
+८ श्री कायस्थिति स्तोत्रालिखान प्रकरण्युम् ...	०-२-०	+३१ श्री कृपसूत्रम् सुअोधिया ...	०-०-०
+९ श्री आवप्रकरण्युम् ...	०-२-०	+३२ उत्तराध्ययनम् ...	५-०-०
+१० नवतत्वलाय ...	०-१२-०	+३३ उपदेश समतिका ...	०-१३-०
+११ विचार पंचाशिका ...	०-२-०	+३४ दुभारापाण प्रजन्य ...	१-०-०
+१२ वृष्णि पृष्ठनिशिका ...	०-२-०	+३५ श्री आचारोपदेश ...	०-३-०
+१३ परमाणु अनु पृष्ठनिशिका— पुरुगव षट्निशिका—नगोद ५८ निशिका ...	०-३-०	+३६ श्री रौद्रिण्या-अशोकयंद्र कथा	०-२-०
+१४ सावचूरिकं आवहतसंग्रह प्रकरण्युम् ...	०-२-०	+३७ गुरु गुण्य पट विंशत् पृष्ठनिशिका कुलकम् ...	०-१०-०
+१५ हेष वन्हन-शुद्धवन्हन-प्रत्याघ्यान लाखनयम् ...	०-४-०	+३८ श्री ज्ञानसार सत्रम् ...	१-४-०
१६ सिद्ध पंचाशिका ...	०-२-०	३९ समयसार प्रकरण्युम् ...	०-१०-०
१७ अन्नाय उच्च दुलकम् ...	०-२-०	+४० सुहृत सागर ...	०-१२-०
१८ विचार समतिका ...	०-३-०	+४१ धर्मिक कथा ...	०-२-०
१९ अन्नप अहूत्वगर्भिनः श्री भगवार रतनम् ...	०-२-०	४२ प्रतिमा शतकम् ...	०-८-०
२० पंचस्त्रम् ...	०-६-०	+४३ धन्य इथानकम् ...	०-२-०
२१ श्री ज्ञम्भूत्वाभि यरितम् ...	०-४-०	+४४ चतुर्विंशति जिनस्तुति संग्रह ०-६-०	०-६-०
२२ श्री रतनपाल तृपत्यानकम् ...	०-५-०	+४५ रौद्रिण्य-इथानकम् ...	०-२-०
२३ सूक्ष्मा रत्नावली ...	०-४-०	+४६ लघुलेन समाप्त प्रकरण्युम् ...	१-०-०
२४ मेधहृत समरया लेखः ...	०-४-०	+४७ अहृतसंग्रहयु ...	२-८-०
		+४८ श्राद्ध विधि ...	२-८-०
		+४९ पृष्ठ दशानेन समुच्चयः ...	३-०-०
		+५० पृष्ठ संग्रह ...	३-८-०
		५१ सुहृत संग्रहीतम् ...	०-८-०
		+५२ सरीकाश्वत्वारःप्राचीनाःकर्मन्या २-८-०	

+ आ नीशानीवाणा पुस्तकोऽसीक्षेत नथी।

+५३ सम्प्रोध समति: ... ... ०-१०-०	६७ धर्म परीक्षा ... ... १-०-०
+५४ कुलत्यमादा कथा ... ... १-८-०	६८ समतिशत स्थान प्रकरण्यम् ... १-०-०
५५ सामाचारी प्रकरण्य आराधक वि- राधक्यतुम् गी प्रकरण्यम् ... ०-८-०	६९ येहय वंहशु भवालासं ... १-१२-०
५६ कृष्ण वज्रायुक्त नाटकम् ... ०-४-०	७० प्रश्न पूर्णिनामा अन्थः ... ०-२-०
+५७ कुमारपाणि चरित्र भवाकायम् ०-८-०	+७१ श्री कृष्णसूत्रम् किरण्यावती ... ०-०-०
५८ भवानीरुद्ध चरित्य ... ... १-०-०	७२ योगदर्शन तथा योगविद्या १-८-०
५९ द्विमुखी मनानन्दम् ... ... २-६-०	७३ भृत्य अकरण्य ... ...
६० प्रभुकृष्णोदिष्यम् ... ... ०-५-०	७४ हैवन्द नरकेन्द्र प्रकरण्यम् ... ०-१२-०
६१ धर्माक्षयम् ... ... ०-४-०	७५ यन्दतीरण्यामा-धनधर्म-सिद्ध- दत्तकपित्र-युमुख नृपातिभिर
६२ पञ्चनिर्मन्थीप्रसापनोपांग त्रृतीय पद संबद्धस्त्री प्रकरण् ... ०-६-०	यतुष्टु-कथा यतुष्टयम् ... ०-११-०
६३ रूपसेहरी कहा ... ... ०-६-०	७६ लैन भेदहृतम् ... ... २-०-०
६४ सिद्ध प्राप्तुं सरीकम् ... ०-१०-०	७७ आवधमः विधि प्रकरण् ... ०-८-०
६५ दानप्रदीप ... ... २-०-०	७८ युरतत्त्व विनिश्चयः ... ... ३-०-०
६६ वाधडेत्य त्रिभागी प्रकरण् ०-१०-०	७९ यतुनिःशति “अद्दरुति” ... " ०-४-०
	पसुहेव हांडी, भाग १ लो... ७५ाय छे.

## ( वगर नं खरेना )

१ सुखद चरित्र ... ... ०-२-०	+७ सातु आपस्यक छियानाइस्त्रो भेट.
+२ जल्य भंजरी ... ... ०-२-०	८ नयोपदेश ... ... १-०-०
+३ गुरुश ना चरित्र ( प्रथमसाग्र ) ०-६-०	९ श्रीपाणि चरित्र ... ... ०-४-०
४ अनुतरौपवाप्त मुन्त्र ... ... ०-६-०	१० गांगेय लंग प्रकरण् ... ... ०-४-०
५ नण दम्यांती सुग ... ... भेट.	११ भूगांक चरित्र ... ... ०-४-०
+६ लैन वृत्त छिया विधि. ... भेट.	

## प्रवर्तीक श्री कांतिविजयज्ञ जैन ऐतिहासिक अंथा,

+१ विरुद्ध निवेशी ... ... १-०-०	५ द्रोपदी स्वयंवरम् ... ... ०-४-०
+२ दृपासागर डोप ... ... १-०-०	६ माचीन लैन लेख संभव भार लो ४-८-०
+३ शत्रुंजय तीर्थोद्धार प्रभव ... ०-१०-०	७ लैन ऐतिहासिक गूर्जर काव्य
+४ प्राचीन लैन लेख संभव भाग १ लो. ... ... ... १-०-०.	संचय. ... ... २-१२-०

+ आ नीशानीवाला पुस्तकों सीलों के नथी.

## ગુજરાતી ભાષાના-ભાષાંતર વિગેરેના અંશો.

૧ શ્રી જૈન તત્વાર્થ ... ... ૫-૦-૦	૨૬ શ્રી સંયુક્ત સ્વરેણ સ્તવ. ... ૦-૪-૦
૨ શ્રી નવતત્વનો સુંદરસોધ. ... ૦-૧૦-૦	૨૩૦ શ્રી આશાગુણુ વિવરણ ભાષાંતર ૨-૦-૦
+૩ દેવસિરાધ્રુ પ્રતિક્રમણ સ્ત્રીનાર્થ ૦-૩-૦	૩૧ શ્રી ચંપકમાળા ચરિત્ર ... ૦-૮-૦
૪ શ્રી જ્ઞાનિયાર વૃત્તિ ... ... ૦-૬-૦	૩૨ કુમારપાળ ચરિત્ર ... ... ૦-૩-૦
+૫ શ્રી અજ્ઞાનતિમિર ભાસ્કર ... ૨-૮-૦	૩૩ સરખાત કૌમુકી ભાષાંતર ... ૧-૦-૦
+૬ શ્રી જૈનવર્મ વિપયિક પ્રક્રોતર ૦-૮-૦	૩૪ શ્રી પ્રકરણ પુણ્યમાળા ... ( દ્વિતીય પુણ્ય ) ... ... ૦-૮-૦
+૭ વિવિધ પૂજા સંઘડ ... ... ૧-૮-૦	+૩૫ શ્રી અનુયોગદાર સ્તવ ... ... ૦-૫-૦
૮ શ્રી દંડક વૃત્તિ ... ... ૦-૮-૦	૩૬ શ્રી અધ્યાત્મમત પરિક્ષા ... ૦-૪-૦
૯ શ્રી નયમાર્ગ દર્શિક ... ... ૦-૧૨-૦	૩૭ શ્રી શુરૂ ગુણમાળા ... ... ૦-૬-૦
૧૦ હંસ વિનોદ ... ... ૦-૧૨-૦	૩૮ શ્રી શયુંજ્ય તીર્થ સ્તવનાવલી. ૦-૫-૦
+૧૧ વિવિધ પૂજાસંગ્રહ બીજી આવૃત્તિ ૧-૮-૦	+૩૯ શ્રી આત્મ કાન્તિ પ્રકાર ... ૦-૪-૦
૧૨ કુમાર વિલાર શાંતક ... ... ૧-૮-૦	૪૦ શ્રી જાનામૃત કાર્યકુંજ ... ૦-૮-૦
૧૩ શ્રી જૈન ધર્મ વિપયિક પ્રક્રોતર બીજી આવૃત્તિ ... ... ૦-૮-૦	+૪૧ શ્રી દેવલક્ષ્મિમાળા પ્રકરણ ... ૧-૦-૦
૧૪ શ્રી જૈન તત્ત્વસાર મુળ તથા ભાષાંતર. ... ... ૦-૬-૦	૪૨ શ્રી ઉપદેશ સમતિકા ... ... ૧-૦-૦
+૧૫ „ ભાષાંતર ... ... ૦-૨-૦	૪૩ શ્રી સંસ્કૃત સમતિકા ... ... ૧-૦-૦
૧૬ શ્રી આત્મ વલભ જૈન સ્તવનાનાથી ... ... ૦-૬-૦	૪૪ શ્રી પંચ પરમેષ્ઠ ગુણ રત્નમાળા ૧-૮-૦
૧૭ શ્રી મોક્ષપદ સોધાન ... ... ૦-૧૨-૦	૪૫ સુમુખનૃપાદ ધર્મ પ્રલાવકાની કથા. ... ... ... ... ૧-૩-૦
૧૮ ધર્મ બીન્દુ અંથ આવૃત્તિ બીજી ૨-૦-૦	૪૬ શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર ... ૨-૦-૦
૧૯ શ્રી પ્રક્રોતર પુણ્યમાળા ... ૦-૧૪-૦	૪૭ શ્રી સુપાર્થનાથ ચરિત્ર ભા. ૧લો ૨-૦-૦
+૨૦ ધ્યાન વિચાર ... ... ૦-૩-૦	૪૮ આદર્શ જૈન સ્ત્રી રત્નો ... ૧-૦-૦
૨૧ શ્રી આવક કલ્પતર ... ... ૦-૬-૦	૪૯ શ્રી સુપાર્થનાથ ચરિત્ર ભા. ૨લો ૨-૮-૦
૨૨ શ્રી આત્મપ્રણોધ ભાષાંતર ... ૨-૮-૦	૫૦ શ્રી હિન્દુપરીપ ... ... ૩-૦-૦
+૨૩ શ્રી આત્મોનતિ ... ... ૦-૧૦-૦	૫૧ શ્રી નિર્બન્ધ પૂજા (અર્થ સહિત) ૧-૪-૦
+૨૪ શ્રી પ્રકરણ પુણ્યમાળા ... ૦-૬-૦	૫૨ શ્રી કાંચ સુધ્રાકર ... ... ૨-૮-૦
૨૫ શ્રી જગ્યાસુનામિ ચરિત્ર ... ૦-૮-૦	૫૩ શ્રી આચાર્ણાદેશ ... ... ૦-૮-૦
૨૬ જૈન અંથ ગાઠડ. ... ... ૧-૦-૦	૫૪ ધર્મરત્ન પ્રકરણ ... ... ૧-૩-૦
૨૭ શ્રી નવાજું પ્રકારી પૂજા ( અર્થ સાહિત ) ... ... ૧-૮-૦	૫૫ શ્રી ગંધ્ય પ્રતિક્રમણ સ્ત્રી ( અર્થ સહિત ) ... ... ... ૧-૧૨-૦
૨૮ શ્રી તપોરત્ન ભલોહિં ભા. ૧-૨. ૧-૦-૦	૫૬ શ્રી આત્મવિશુદ્ધિ ... ... ૦-૬-૦

+ આ નિયાનીવાળા પુસ્તકો શીલીકમાં નથી.

५७ कुमारपाल ग्रतिष्ठोऽथ... ...	३-१२-०	६० श्री विमलनाथ चरित्र ...	१-१२-०
५८ लैन नररत्न " लामाशाह " ...	२-८-०	श्री प्रभावक चरित्र ...	७४४ छे.
५९ आत्मानंद सज्जानी लालचेत्रीनुं अक्षरानुष्ठम लीट... ...	०-१४-०	श्री चंद्रभूष चरित्र ...	...
		श्री महानीर स्वामी चरित्र... "	"

---

## अन्य ग्रन्थे.

तत्त्वनिष्ठय प्रासाद... ...	१०-०-०	चैत्यवंहन चोवीशी ...	...	०-६-०
अभयकुमार चरित्र भा. १ ला.	२-४-०	प्राणग्रेम पुण्यमाणा ..	...	
अभयकुमार चरित्र भा. २ लो.	३-०-०	धर्म अने छवन ...	...	०-३-०
सज्जायमाणा भाग १ थी ४ हरेकना...	२-०-०	महिला महोहय भा. १-२ हरेकना	२-०-०	
इर्मथंथ दिंदा भा. १ लो. (हीटी)	१-४-०	लैन महालालत सचित्र... ...	...	६-०-०
सहर भा. २ लो. (,,)	०-१२-०	राजकुमारी सुहर्दीना...	...	३-०-०
सहर भा. ३ लो. (,,)	०-८-०	भवया चुंहरी ...	...	२-८-०
सहर भा. ४ चो. (,,)	२-०-०	श्रीपाणि राजनो रास (सार्थ सचित्र)	२-०-०	
६-३५ ... ... (,,)	०-३-०	सम्मेतश्चिभर चित्रावली	...	२-८-०
वितराग रतोन ... ... (,,)	०-३-०	उत्तम कुमार ( सचित्र )	...	१-४-०
सज्जन सन्मित्र ... ...	४-०-०	ना रचन्द्र ज्योतिष्य ...	...	३-०-०
सिद्धांत मुकुतावली ... ...	०-१०-०	लक्ष्माण संहिता ...	...	२-०-०
जैनलानु ... ...	०-८-०	विवेक विकास ( सचित्र )	...	३-०-०
विमल विनोद ... ...	०-१०-०	समराहित्य डेवणा चरित्र	...	५-०-०
विशेष निष्ठय ... ...	०-४-०	पूर्ण संअद सचित्र भा. १ थी ७	५-०-०	
अविद्या अंधकार मार्त्ति ... ...	०-४-०	नवपद ज्ञाणी विधि... ...	...	०-१२-०
श्री नवपद्धति पूर्ण श्री गंभीर वि इत ०-२-०		नवपद्धति मंडणी छ्या ...	...	०-४-०
पूर्णसंअद शास्त्री विज्ञानंद सरि-		सिद्धांशुक्तिष्ठना यंत्रनी छ्या ...	...	०-२-०
विज्ञानस्त्वलभस्तुरि-श्रीहंसवि. भ. इत. १-४-०		चौह २०८६०८१५ पूर्ण ...	...	०-१-०
आत्मवक्षब पूर्ण संअद ... ...	१-८-०	सम्यक्त्व दर्शन पूर्ण ...	...	०-१-०
सप्तरंभेदी पूर्ण ( हरभेनीयम नोटी-		पंथग्रतिकमलु कृत, गुजराती ...	०-१०-०	
सन सारीगम साथे... ...	०-४-०	(,,) शास्त्री ...	०-१०-०	
जैनसती रतो ( सचित्र ) ... ...	१-४-०	देवसीराध प्रतिकमण्य, गुजराती	०-४-०	
जैनगीता ... ...	१-०-०	(,,) शास्त्री ...	०-४-०	
प्रभेष रत्न डाय ... ...	०-८-०			

૬

## સુંદર ફોટોયો ( છખીયો ).

મુનિમહુરાજાના દરેક સાહિત્યી છખીયો તથા તીર્થોના રંગીન નકશા અને ફોટો.

તથા કલકૃતાવાળા નથમલ ચાંડાલીયા ફોટોઆફ્રે લાલમાં એવા નિવિધ રંગોથી તૈયાર કરેલા સુંદર, મનોહર અને આકર્ષણીક ફોટોયો બહાર પાડ્યા છે.

શ્રી કેમરીયાજી મહારાજ	૧૫+૨.૦	૦-૮-૦
શ્રી ચંદ્રગુમના સાગ સ્વર્પન ( સમજણું સહિત ) ..		૦-૮-૦
મધુ બિંદુ	" "	૦-૬-૦
પદ્મલેશ્વા	" "	૦-૬-૦
શ્રી જીનદત્તસરિજી-( દાદાસાહેબ ) ..	" "	૦-૬-૦
પાવાપુરીનું જીન મંદિર	૧૨+૨૦	૦-૮-૦



## પુના ચિત્રશાળા પ્રેસની રંગીન છખીયો.


શ્રી ગૌતમભસ્વામીજી મહારાજ	૧૫+૨.૦	૦-૧૦-૦
શ્રી મહાવીરસ્વામી ભગવાન	૧૫+૨.૦	૦-૮-૦



સૂચના—સિવાય અમારે ત્યાં જૈનધર્મનાં તમામ અંથો, એવા ડેશ-શાઢ લીમરણી માણેણું સુંબદ્ર, શાઢ મેધજી હીરજી-મુંબદ્ર, શ્રી જૈનધર્મ પ્રસારક સભા-જૈન ઓારીસ-ભાવનગર શેડ દેવચંદ લાલભાઈ પુરતકોણાર ઇંડ-મુંબદ્ર, શાઢ હીરાલાલ હંસરાજ-જમનગર, સલેત અમૃતલાલ અમરચંદ-પાલીતાણ્ણા, શ્રી જૈન સરતી વાંચનમાળા-ભાવનગર, નથમલ ચાંડાલીયા ફોટોઆફ્ર-ક્લેક્ટરા. વિગેરે પુરતકો પ્રકટકર્તાના તમામ પુરતકો, તેમજ અન્યના પુરતકો, નકશાઓ, અને મુનિરાજ તથા તીર્થોના તેમજ શ્રી તીર્થિંડ્ર ભગવાન તથા શ્રીગૌતમભસ્વામીના ફોટોયાદ ( છખીયો ) અમારે ત્યાંથી ભણશે. નશે જ્ઞાનઘાતામાં જય છે, જેથી મંગા-વનારને તે પણ લાલ થાય છે.

લખો:—શ્રી જૈન ચાત્માનંદ સભા—

**ભાવનગર.**



## લાઈફ મેમ્બર.

દ્વાધિપત્ર પ્રેતાંભર મૃત્તિયુજ્ઞ જૈન આ સભામાં સભાસદ તરીકે દ્વાખલ થઈ શકે છે.

એક સાથે રૂ. ૫૦૦) આપનાર ગૃહસ્થ આ સભાના પેટન (માનવંતા મુખ્યમી) થઈ શકશે.

એક સાથે રૂ. ૧૦૦) આપનાર પહેલા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે.

એક સાથે રૂ. ૫૦) આપનાર ડીન વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે.

જૈન લાઈફરી, શાળા કે સંસ્થા મેમ્બર તરીકે રજુસ્ટડ્ર થવા માગે તો રૂ. ૫૦) ભરવાથી ડીન વર્ગના લાઈફ મેમ્બરના હક્કા જોગવી શકશે.

પહેલા વર્ગના લાઈફ મેમ્બરને સભા તરફથી પ્રગટ થતા પુસ્તકની એક એક નકલ તથા આત્માનંદ પ્રકાશ માસિક તેમની છાંદગી સુધી લેટ્યુઆપવામાં આવશે.

ડીન વર્ગનાં લાઈફ મેમ્બરને સભા તરફથી પ્રકાશિત થતા એ ઇપીઆની કિંમત સુધીના દ્વેક થાંથની એક એક નકલ બેટું આપવામાં આવશે, તેમજ આત્માનંદપ્રકાશ માસિક પણ તેમની છાંદગી સુધી બેટું ભરશે.



## આત્માનંદ પ્રકાશ.

ઉપરોક્ત માસિક સભા તરફથી છાંદા વર્ષથી પ્રકટ થાય છે. તેમાં ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક અને નૈતિક ઉપરાંત છી ડેણવણી અને વિદ્યાર્થી વિભાગ વાંચનના લેખેં પણ આવે છે, કે જેથી રીતિનું જૌરવ તેમનું માતા તરીકું રથાન અને ભાગડાને ઉત્તમ સંસ્કાર કેમ આપી શકાય ? તે તથા સમાજની ભાવિ ઉભતિમાં છીએ અને વિદ્યાર્થીઓ કેમ આદર્શી અને તે માટે ઉત્તમ લેખો આપવામાં આવે છે, જેથી વાંચન માટે સમાજની ઇચ્છી વધતા તે માટે અનેક પ્રશંસાના પંત્રો આવેલ છે. મંગાવી આવી કરો !

વાર્ષિક લાયાજમ રૂ. ૧-૪૦ વાર્ષિક બેટનું સુંદર હણદાર પુસ્તક તથા પંચાંગ બેટું આપવામાં આવે છે.

## પુસ્તક પ્રકાશન ખાતું.

આ સભા તરફથી આજે ત્રીશ વર્ષથી ચાહુ છે. અમારા તરફથી પ્રકટ થતા ગુજરાતી સંસ્કૃત, માગધી, હીની વિગેર પુસ્તકોની સાહિત્યરસીક સાક્ષરો સુકટકંઠ પ્રશંસા કરે છે, જેથી તેનો લાલ લેવા ન ચુક્યો, નંદો જાનભાતામાં જય છે. સીરીઝ સિવાયના અન્ય અથી પડત કિંમતે આપવામાં આવે છે.

લેખો:-

શ્રી જૈન આત્માનંદ સભા—ભાવનગર.

— ਤਮਾੜ੍ਹ ਨਾਮ ਅਮਰ ਕਰਵੁਂ ਛੋਥ ਤੋ —

ଆଟିଲୁ

વાંચી નિર્ણય કરી લયો.



**અંથમાદા** પ્રસિદ્ધ કરાતી તે અમૃત્ય લાભ મેળવો.

શ્રીમતી.

ને ગુજરાત ઓછામાં ઓછા રૂ. ૧૦૦૦) એક હજાર આ સભાને આપે તેમના નામથી અંધમાળા (સરીરજ ) ( અંધા ) આ સભાએ દરેક વખતે નીચેની શરતે પ્રકટ કરવા.

૨ સીરીઝનો પ્રથમ અંથ છપાવવાને માટે વધારેમાં વધારે રૂ. ૧૦૦૦) સુવી આ સમાચે ખરચ્યવા.

૪ અમુક સખ્યામાં જાહેર લાઈબ્રરી કે ભાડાર તેમજ સાચું સાચી મહારાજ વગેરેને આ સિરિઝના થયો સબાના નિયમ મુજબ ને ને બેટ અપાય તે તે ‘સિરિઝચાલાની વતી સલા માર્કેટ બેટ’ એવી ચીઢી છપાવી પુરતક ઉપર ચોડી બેટ મોકલવામાં આપશે.

૭ તે સીરીઝની છપાતી દરેક શુક્રની પચીશ કાર્યી ને ગુદુસ્થના તરફથી આંધ્યમાણ સીરીઝ છપાય તેમને બેટ આંપવામાં આવશે.

‘ते सीरीजना प्रथम अडधा अथें अपी गया होय ते सभ्ये उपशेळा ते रकमना प्रभाण्यमां ते गृहस्थना नाभर्थी भीज्ञे अंथ (सिरिजनो ) सआणे ल्पाववो शड करवेह; अज्ञ कम साच्यनी सिरिजना भीज्ञ अथें सलाम्ये निरंतर अपाववा.

૧૦ અંથમાળાના પ્રયમના એકજ અંથમાં સીરીજવાળા ગુહસ્થનું કુંકું જીવનયરિત, ફેટોઆફ અને અર્પણી પત્રિકા તેમની ઘંથનુસાર ( એકજવાર ) આપવામાં આવશે.

નીચેના પ્રમાણેના મહાશયોના નામથી અંયમાળાઓ પ્રકૃત થઈ ચુકી છે.

- |   |   |
|---|---|
| ૧ શેડ આણુંદુષ પુરુષોત્તમદાસ.            | ૨ વોરા હડીયંદ જવેરચંદ                       |
| ૩ શ્રીમાન સુખસાગરજી મહારાજ              | ૪ શ્રીમાનુંચાચાર્ય શ્રી ભુદ્ધિસાગરજી મહારાજ |
| ૫ વકીલ હરીયંદ નંબુલાઈ                   | ૬ શ્રી આત્મવલ્લભ અંથમાળા                    |
| ૭ શેડ નાગરદાસલાઈ પુરુષોત્તમદાસ રાણુપુર. | ૮ શેડ જનેરસાઈ લાઈચંદ                        |
| ૯ રાહ મગનદાલ ગોધુવજી                    | ૧૦ શેડ અમરચંદ હરળુષનદાસ                     |
| ૧૧ શેડ હીપચંદ ગાંડલાઈ                   |   |

ઉપરના મહાશયોએ પોતાની લક્ષ્મીનો સહભ્રય કર્યો છે; આપ પણ વિચારી તે રહ્યે ચાલતો અયતનશીલ થઈ સાહિત્યના ક્ષેત્રમાં આપનું નામ અમર કરશો. તેમ છથ્યાએ ધીરે.

લખોઃ—શ્રી જૈન આત્માનંહ સભા.—ભાવનગર.

આનંદ કૃતી, પ્રેરણ-ગુજરાતિયાર.

ॐ

ॐ श्री ज्ञानेश

ॐ

# आत्मभानन्द प्रकाश.

॥ वन्दे वीरम् ॥

ओचित्यादुचितप्रवृत्तिरूपत्वात् । वृत्तयुक्तस्यागुत्रतमहाब्रतसमन्वितस्य । वचनाज्ञिनप्रणीतात् । तत्त्वचिन्तनं जीवादिपदार्थसार्थपर्यालोचनम् । मैत्र्यादिसारं मैत्रीप्रमोदकरणामाध्यस्थ्यप्रधानं सत्त्वादिपु विषयेषु । अध्यात्मं योगविशेषं । अतोऽध्यात्मात् । पापक्षयोज्ञानावरणादि क्षिष्टकर्मप्रलयः । सत्त्वं वीर्योत्कर्षः । शीलं चित्तसमाधिः । ज्ञानं च वस्त्रवबोधरूपम् । शाश्वतमप्रतिघाति शुद्धं स्वतेजोवत् । अनुभवसंसिद्धं स्वसंवेदनप्रयत्नं तद्वृत्तम् । अमृतं पीयूषम् । स्फुटं भवति ।  
योगविन्दु—श्री हरिभद्रसूरि.

ॐ

पुस्तक २९ } वीर सं. २४९७. आवण. आत्म सं. ३६. { अंक १ लो.

॥ ॐ ॥

## प्रारंभ.

प्रातःस्मरण्.—

सूत्र.

॥ ॐ तत् सत् परमात्मने नमः ॥

भंगल—प्रार्थना.—

( प्रलापि. )

( राम लज्जने प्राणीआ—ऐ चाल. )

जयवंत वीर निनेद्रने, प्रारंभमां प्रथमो सहु;  
 “जाणे साल जग जुपलेणी,” शान गौरव सर्दु.—जय० १  
 “के चरम स्थापक तीर्थना” अवतरण यान अवाधिमां;  
 अज्ञान तिभिर विनाश ४२, अगवान सार्थ समष्टिमां.—जय० २  
 निष्ठाम जन्मु—नाथ साथे, पिता पूज्य यविन ऐ;  
 शुद्ध राय साचा जगत जनना, योधी शुषु गरिष्ठ ऐ.—जय० ३

२

## श्री आत्मानंद प्रकाशः।

सन्मार्ग दर्शक परम योगी, विविध योग विशेषथी;  
 सहस्रान्-दर्शन-यरणु शुद्धि, परम प्रबु उपदेशथी.—७४० ४  
 “ अति छर्ष सहु आ वर्षमां, सेवा अने सद्योगथी ”  
 आर्यत्व आविक्षाव धार्म, संस्कृति संयोगथी.—७४० ५  
 “ भतलेह थाय अलेह भातृ—लावना प्रकटे ” अने;  
 रटता विभुवरवीर साचो—कुम्हयोगी ए अने.—७४० ६

नियत-निर्देशः— ( हरिगीत )

( १ )

सह देव-गुरु अने धर्मनी सात्विकता समजवतु,  
 घैतन्य—जडनी विविधदृपे वहेयाणी अतलावतु;  
 मार्गानुसारी अगर व्रतधर सर्वने अपनावतु.  
 सभ्यदृत्व दृढतर काज लोगी लावना यत्तावतु.

( २ )

४३ वासनाना प्रभर सभये आत्म रस रेलावतु,  
 जनहित आहि प्रक्षना उडेलने उपजवतु;  
 “ आन्होलने आत्मिक आनंदना सहा प्रकटावतु, ”  
 आशीष आत्मानंदनी सौजन्य रंग जमावतु.

ॐ शान्तिः !

( वेलचंद धनण् )

—\*—

## जिनेन्द्र स्तवः

रचयिता न्यायतीर्थ मुनि हिमांशुविजयः ( ‘ अनेकान्तो ’ )

१

अनन्तसौन्दर्य ! जिनेन्द्रवन्द्र, ! तमः प्रणाशिंश ! सुयोगिमुद्दृढ ! |  
 यदा तदा त्वं मम दृष्टिमार्ग—मुपैषि मुद्, सा वदितुं न शक्या ||

१ शोकेऽस्मिन् रूपकानुप्राप्तालंकारौ । २ हर्षद ! ।

## जिनेन्द्र स्तव०

३

२

जिनेन्द्रैरूपस्तु जिनेन्द्र एव जिनाऽस्यतुल्यं च जिनौस्यमेव ।  
नमोनिभं स्यान्नभएव नान्य—देतादृशां नहमुपमानवस्तु ॥

३

सद्गुर्क्षयपूज्यपादौय पूङ्कशोषयशस्वते ।  
सच्चित्ताऽकाशकौशाय नमोऽस्तु जिन्मास्वते ॥

४

पूज्यानामपि पूज्यं हि ब्रतेष्वग्रेसरं तथा ।  
दानेष्वपि बृहदानं ब्रह्मचर्यं समस्ति यत् ॥

५

धर्मकीर्तिशिवानां यत् प्रौढपुष्टिप्रकारकम् ।  
ब्रह्मचर्यं भजध्वं तद् वाग्भटेनापि भाषितम् ॥

६

दयादानक्षमाधर्मा भक्तिमंत्रादयः पुनः ।  
ब्रह्मचर्यादिना विश्वे न सिध्यन्ति सतामपि ॥

७

न दुष्करं दुष्करकार्यसाधनं, न दुष्करं दुष्करकष्टमैर्षणम् ।  
वह्नौ प्रवेशोऽपि न दुष्करः स्मृतो, ब्रह्मत्रतं दुःकरदुःकरं त्वहो ॥ (!)

इत्योः शान्तिः ३



३ जिनतुल्य, अत्रा नन्यथालंकारः । ४ जिनमुखं । ५ जिनपदो क्रमौ, सूर्यपक्षे  
किरणा, ६ कर्दमः, पापं च, । ७ प्रकाशकाय । ८ भास्वानिव जिन., जिन एव भास्वान् वा तस्मै॥  
अत्र वृत्तेरूपमावालङ्कृतिः अन्त्यानुप्रासादिकाश्रशद्वालङ्कारा जाप्रति ॥ ९ वाग्भटकुतेऽष्ट झहवये  
ग्रन्थे । २ सहनं ।

## नूतन वर्षनुं मंगलमय विधान.

**प्रकाशनो भ्रवेश.**

आत्म ज्योतिना उज्ज्वल किरणो। वडे लैनदर्शननां उच्च तत्त्वोद्दारा पाश्चात्य विज्ञानवाद ( Science ) प्रति आध्यात्मिक प्रकाश प्रसारतुं, संसारी ज्ञाने सत्कर्म अने हुँकर्मनुं भान अर्पतुं, भनुष्योना आत्माना गुणस्थानक्नी प्रगतिने भापतुं, तत्वा धर्मशान सद्गुणान अने विरतीरप त्रिपुटीनो सुंहर संयोग जन्मावतुं, सकल सुषिना अनंत पदार्थीमांथी आत्मा-हुं ने शोधी काढी ओगभावतुं अने कर्मनो। कठीं दतीं अने बोक्ता हुं कुं ए प्रकारे स्वावलंबन पूर्वक, पुरुषार्थ परायण थवानी जगृति अर्पतुं “आत्मानंह प्रकाश” आने २८ भा वर्षमां भ्रवेश करे छे.

**काल अने ज्ञान.**

प्राणीभावने पोतपोताना जुहा जगत् होय छे; ऐकज सृष्टि उपर विदरवा छतां, ऐक ज सूर्यनी हुँक्तगे वसवा छतां अने ऐकज प्रकारना अनवडे स्थूल हेहतो निर्वाण कर्ये जतां छतां अत्येक ज्ञने पोतानुं साचुं विश्व निराणुं होय छे; अने ते ज्ञना तारतम्य अतुसार रचयेल होय छे; स्थूल सृष्टि उपर पशु ज्ञनी दृष्टिमयीदाने लघने तेनुं जगत् नानुं भोटुं होय छे तेवीज रीते आध्यात्मिक सृष्टि संबंधमां तो ए हकीकत ते करतां पशु अनेक गुण सत्य छे; आत्मानंह प्रकाशनी पन्नसृष्टि कागण अने अक्षरो इपे स्थूल सृष्टि गण्याय परंतु आध्यात्मिक दृष्टिए भावना सृष्टिमां रचनात्मक रीते ( Constructively ) पोताना वांचनो जे जे सार भाग जे जे भनुष्योने हृष्ट-रप्तर्षी बनाव्यो छे, तेनी गण्यना करतां तेना आध्यात्मिक ज्ञननुं भाप थध शके छे. काल अनाहि अनांत छे परंतु सम्यग्दर्शन-ज्ञान अने चारित्र डारितुं ज्ञन व्यक्तिनी द्रष्टिए साहि अनांत छे; आवा आध्यात्मिक ज्ञननी आहि प्रकटाववा अने काल अने ज्ञननो ए रीते समन्वय साधवा “आत्मानंह प्रकाश” भीमी पशु भक्तम प्रगति करी रख्युं छे.

**संज्ञानो उपनय.**

२८ नी संज्ञा (term) चोलीशमा चरम तीर्थंकर श्री वीर परमात्माए प्रभोधित काल-स्वभाव-नियति-उद्घम अने कर्मशील पांच कारणो। वडे प्रत्येक आध्यात्मिक तेमज व्यावहारिक कार्यनी सिद्धि सूचवे छे. आ पांच कारणोमांथी गमे ते संलेगेमां ऐक मुख्य होय परंतु चार गौण्यपछे कार्यसिद्धिना कारणो। इपे होय छे ज; प्रत्येक देखोना वांचनमां पशु उद्घमनी साथे प्रत्येक आत्माना कर्मो-भवितव्यता विग्रे उपर पशु सह-गता निळगतानो मुख्य आधार छे; परंतु आस करीने प्रत्येक आत्माए उद्घमने मुख्य करीने श्री वीर परमात्माए प्रभोधित साध्य तरक्क प्रगतिमान थनुं जेहच्चे; जेथी प्रभज

## नूतन वर्षानु भंगलभय विचान.

५

जिवम पुरुषार्थ आगण अवितव्यता विग्रेरे कारणो अवस्थ गौण्य बनो जतां योगदर्शननी परिलापा प्रमाणे “ संयमाद्विवेकजं ज्ञानं ” प्राप्त थतां अंतरात्म अवस्थामां आगण वधतां वधतां परमात्मपदमां रिथर थवानो समय अवस्थ आवी पहुंचे छे. परंतु श्रीमह आ-नंदधनश्चना कथनानुसार निर्दिष्टप्रये ‘आत्मार्पण’ थाय तोज ४४सिंहि प्राप्त करी शकाय छ. वीर परमात्मानी शुभ संगानी साथे पांच कारणोना सरवाणार्ही समन्वय साधतुं आत्मानंद प्रकाश ” उत्तरकालीन भंगलभय विचाराथी नूतन वर्षमां प्रवेशतां गौरवयुक्त अलिनंदन दे छे.

### गत वर्षानां संस्मरणोः।

गत वर्षमां हीक्षाना प्रश्ने जैन समाजमा भोटा कालालव भयावी मुक्यो छे; जैने यंगमेन्स सोसाइटी अने जैन कैन्फरन्स ए ए मुख्य विभागोमां विलक्त करी दीधा छे. ज्यारथी देउकां प्रकरण, आस्तिक नास्तिकना व्यक्तिगत आक्षेपो, हीक्षाना रथण काण, व्यक्तित तरइ अधिकारनो उपयोग, विग्रेरे सर्व वस्तुओअ साधु साधुओमां तेमज गृहस्थामां पछु अवो पक्षबोद ज्ञानावी हीधो छे के जाणे वीरशासन अने जैन तथा जैन युवक मंडण पत्रिका अने जैन युवक संघ पत्रिका विग्रेरे परस्पर विरोधी भंतव्यवाणा पत्रोअ युद्धना भोरच्या मांडया होय अने गमे तेवी सत्य लक्षितनुं पछु परस्पर खंडन प्रलेक अहवारीये चालुज होय तेवा देखावो थैर रखा छे; आ अधुं जैन समाजनी अधोगतिनुं प्रत्यक्ष चिन्ह छे; अने ते क्लेशार्ही दावानणनुं परिष्याम जैन समाज शरीरनो डेटली दह सुधी छास कर्शे ते काणना गर्भमां छुपायेकुं होइ कही शकाय तेम नथी. पूर्णपाद मुनिराज श्री विजय वक्ष्यालक्ष्मिरिजु तेमना योताना तरक्थी ‘प्रत्याधात’ नदि करवा छतां वारंवार वीरशासन तरक्थी अनेक आक्षेपो मुकाता ज्य छे छतां तेओअ अभूतपूर्व शांतता अद्यणु करी छे. पन्यासञ्च श्री रामविजयज्ञज्ञे-जे हीक्षाना प्रश्ने आरक्षे अधो जैन समाजमां अण्डगाट भयावी मुक्यो छे तेने-ध्यानमां लघ-विद्यानो सहुपयोग करवा मंडनात्मक शैक्षि अद्यणु करी देशकाणभावनो विचार करी उचित आकारमां अनती ताक्षह समेती देवो नेइअ; तो ज जे गंभीर परिस्थितिना तेओ नियामक गण्याय छे ते परिस्थितिने योतानेज दाथे सुधारी शक्षे अने अे रीते जैन समाजनी अवनतिने आणी राजवानो सुंदर यथा छेवटे पछु संपादन करी शक्षे परंतु क्लेश निवारणु करवानी आ भावना तेमना हृह्यमां तेमज तेमने अनुसरनारा वर्गमां आवे अने सहयुक्त तेमनी प्रेरक थाय तोज अनी शक्ते. यीजु तरइ युवक संघ पत्रिका विग्रेरे तमाम पत्रोअ पछु आभोश पक्षवानो नेइअ; अने जैन समाजनी अग्रंड अेकता उल्य पक्षोना समन्वयथी (Compromise) केम प्राप्त थाय तेने माटे अनती त्वराअे प्रथत्न करवो नेइअ; अभारी नभ्र मान्यता प्रमाणे हीक्षाना प्रश्ने निर्णयात्मक स्वरूपमां मुक्तवा माटे ते प्रश्नवाणा उल्यपक्षे तरस्थ भद्रान् व्यक्तित श्री विजयनेभिसूरीथिरल्प पासे ज्ञुं नेइअ अने तेओाश्रीना भारक्षत जे निर्णय आवे ते उल्य पक्षोअ मंजुर राणी अेकता साधवी नेइअ; जेथी अनेक मतुष्योने हुर्ध्यान्तुं निभित बंध थाय अने जैन

## શ્રી આત્માનંદ પ્રકાશ

સમાજ અખંડ એકતાથી પ્રગતિના રચનાત્મક કારોં કરવા તત્પર થાય. અમે પણ રામવિજયજીને એક વિશેષ વિનંતિ એ કરીએ છીએ કે ત્યાં પાઠણમાં બિરાજતા વયોવૃદ્ધ પ્ર૦ કાંતિવિજયજી મહારાજ ઉપર આંશ્ક્ષે નહિં કરતાં સાથે ઇથરમાં સ્વયમેવ પ્રેમપૂર્વક અને સન્માન પૂર્વક ભળા ઔક્ય સાધ્યા અને તેમના અને પૂછ મુશ્કેલિયતા મહારાજ દ્વારા. પૂછ વખ્ખસુરી સાથે હૃદયશુદ્ધ પૂર્વક સંગઠિત થાયો. એથી પૂછ સહગત આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના પરિવારની અખંડતાનો લાલ મેળવવા સાથે જૈન સમાજના પક્ષ-ભેદવાળા યુદ્ધ મોરચા અંધ થવાના નિમિત્તભૂત થશો; અને ભવિષ્યના જૈન સમાજના વારસોમાં કલેશના સંસ્કારો પડતા અટકશે અને એ રીતે અભૂતપૂર્વ શ્રેય સાધી શકશે; હવે પત્ર સુધિની રણભૂમિમાં લડતો ધારી થઘ ગઈ છે; માટે પૂછ શ્રી રામવિજયજી તરફની અમારી વિનંતિ નિર્ણય નહિં જ નીવડે તેવી આશા રાખીએ છીએ. એ રીતે દીક્ષા પ્રશ્નોનો નિવેદા (Judgement) મેળવ્યા પછી ‘સાંદ્રુ સમ્મેલનની’ તાત્કાલિક આવસ્યકતા અમે જોઈએ છીએ.

લાલમાં વડોદરાની ધારાસલામાં દીક્ષાને અંગે સાંદ્રુએ માટે તેમજ મહાગાર માટે સળ અને હંડની શિક્ષાએ ધારાડે થવાનો સમય આવી પહોંચ્યો છે; તે દેશ-કાળ-ક્ષેત્ર અને ભાવ ઉપર દાખિ રાખવા સૂચવે છે. જેથી દીક્ષાના પ્રશ્નો ઉચિત રીતે નીકાલ કરી નાંખવામાં જ શાસનની શેખા છે તેમજ સંપની એકાયતા છે. સમ્મેલનમાં જૈન ધર્મના સિદ્ધાંતોને ક્ષતિ ન પહોંચ્યે તેવી રીતે એકંદરે તમામ ધાર્મિક વિવાહસ્પદ પ્રશ્નોનો વ્યવહાર ઉકેલ થછ જવો જોઈએ.

ગત વર્ષનાં સંસ્મરણોમાં અમદાવાદમાં પોશ વહી ૧૩ ના રોજ શ્રી હેશવિરતિ ધમાં-રાધક સમાજ તરફથી જૈન સાહિત્ય પ્રદર્શન મુલ્લું મુકાયું હતું; પ્રસ્તુત પ્રદર્શનનો પ્રેયત્ન અસુક અંશે સફળ થયો હતો. તાડપણો, ડેરાને લખાએલ ગ્રંથો, સુંદર ચિત્રો, શ્રીયુત જી માણેકલાલભાઈનું સોના-ચાંદીનું દેવમંદિર, ધર્મધ્વજ વિગેરે દસ્તો હતા; પરંતુ આ દશ્યો એ પ્રદર્શન માત્ર નહિં અનતાં તેની પાછળ સાહિત્યની મહત્તમા, જૈન ધર્તિદાસ અને જૈનેતર જગતમાં જૈન દર્શનની ગૌરવતા એતિહાસિક દાખિએ સિદ્ધ કરવા હજુ અનેક સાધન પ્રયત્નો અધિક કરવામાં આવે તારે જૈન સાહિત્ય પ્રદર્શનની વાસ્તવિક સાર્થકતા સિદ્ધ થછ શકે.

પવિત્ર તીર્થીધિરાજ શ્રી શત્રુંજયની છેલ્લા થયેલા ઉદ્ઘારની ચારસોમી વર્ષગાંઠ પ્રત્યેક સ્થળે અપૂર્વપણે ઉજવાએ છે. જૈન સમાજ માટે તે અપૂર્વ મહોત્ત્વનો દિવસ હતો અને દર્શન પ્રભાવનાનું મુખ્ય નિમિત્ત હતું.

ગત વર્ષમાં જૈન સમાજની લવિષ્યકાળની ઉનનિ માટેનું એક મદત કાર્ય ખાસ નોંધવા લાયક છે. ભારતના વિશ્વવિદ્યાલય અને તત્ત્વચિંતનક શ્રી રવીંદ્રનાથ ટાગોરે ખાંગાલમાં રથાપેલા. શાંતિનિકેતન નામના જગતપ્રસિદ્ધ, આશ્રમ કે જેમાં જગતના સર્વ ધર્મો અને દર્શનોના અભ્યાસીએ માટે રથાપિત કરેલ વિશ્વભારતી નામની સંરથા છે એ સંસ્થામાં જૈન સંસ્કૃત પ્રાકૃત એતિહાસિક વૈજ્ઞાનિક તુલનાત્મક જ્ઞાનાભ્યાસ માર્ગેનો

## જૂતન વર્ષાંતું મંગલમય વિધાન.

૭

વિશિષ્ટ પ્રબંધ થવા માટે તેમજ જૈન આગમ કથા-વાહુમય સ્થાપત્ય અંથલંડાર વિગેરેનો અભ્યાસ કરી જૈન ધર્મને જગતના ધર્મેની હોળમાં વિશાળ ધર્મ તરીકે અડે કરવા માટે જૈન નરરળ ખાલ્યું સાહેય અહારુરસિંહજી સિંધીએ ઉદ્ઘારતા પૂર્વક એ લાખની આર્થિક સહાય આપવાથી તેમજ શ્રી જિનવિજયજી જેવા યોગ્ય અધ્યાપકની પ્રાપ્તિ થવાથી ભવિષ્યમાં જૈન વિદ્યાધ્યયન માટે ઉત્તમ જ્ઞાનપીઠ પ્રતિષ્ઠિત થયેલ છે.

કલકત્તામાં ગત જેણે માસમાં જૈન ઉપાશ્રયવાળા મફાનમાં ( શ્રી યશોવિજયજી જૈન શુદ્ધકુળ સંરચાપક રવર્ગવાસી મુનિશ્રી ચારિવિજયજી કંશીના સુશિષ્યો ) મુનિરાજશ્રી દર્શનવિજયજી જ્ઞાનવિજયજી તથા ન્યાયવિજયજીના સદ્ગુર્પદેશથી ઉપાશ્રય સાથે જિનાલયની જરૂરીઓના ધાર્થી વખત જોધ હતી-તે પ્રતિધા થયેલ છે. કલકત્તા જેવા ડિંહુરલાનના ભૂતકાળના પાટનગરમાં આ ઉત્સવ અદૌરીકિં રીતે સફળ થયો છે. ઉપરોક્ત મુનિ ત્રિપુરી ડાઈ પણ વાદવિજાહમાં નિરર્થક નહિં પડતાં રચનાત્મક રીતે જ્ઞાન હર્ષન ચારિત્ની ઉન્નતિના કાર્યો કર્યે જાય છે. પુનામાં સાહિત્ય સમ્મેલન પણ આ ત્રિપુરીએ જ પ્રથમ ઇતોહમંદ રીતે પસાર કરાયું હતું.

અદિસાત્મક રીતે સ્વરાજન્ય મેળવવા ઉદ્ઘૂકતા થયેલા અનેક જૈન અંધુરીએ જેલને મહેલ માની વધાવી લીધી હતી અને સ્વદેશ સેવક તરીકેની જૈનોની અગ્રગણ્ય સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

પુનામાં ઉપધાન તપ, પૂજયપાહ શ્રી વિજયવલ્લભ સુરિજીના ઉપદેશથી સંબંધે કલેશ દૂર થતાં કરવામાં આવ્યો હતો. તેમજ અધેરીમાં પણ ઉપધાનવહનની પ્રશસ્ત કિયા થઈ હતી તેની સહર્ષ નોંધ લઈએ છીએ.

મુંઅધ્યમાં શેષ મોદનલાલ હેમચંદ જવેરીએ સેવાકાર્ય માટે કી વાપરવા આપેલા મફાનમાં તેમજ બીજી રીતે કરેલ સલાયવડે કેંગ્રેસ કી હોસ્પિટલમાં-સરકાર તરફથી થયેલા લાડીચાર્જના ટાઇમે ધાર્યાલ થયેલા અસાલકરી રાષ્ટ્ર સેવકોની શુશ્રૂષા ધાર્ણિજ સુંદર વ્યવસ્થાથી અનેક જૈન અંધુરીએ તરફથી તન મન ધનના લોગે કરવામાં આવી હતી; જૈન સમાજ રાજકીય દિશિબિંહુએ સેવાના કાર્યક્ષેત્રમાં આત્મલોગ ( Self-sacrifice ) માટે પ્રગતિમાન થઈ રહેલ છે તે માટે અત્યંત ઝુશી થવા જૈનું છે.

મહાવીર વિદ્યાલયને શેષ મેધા સોનપાળ તરફથી ગત જુન માસથી ઉદ્ઘારતા પૂર્વક મેટી રકમ અર્પણું કરવામાં આવી છે; તે શિક્ષણ સહાયક ઇંડવડે ન્યાયતીર્થ અને વ્યાપરણ તીર્થની પરીક્ષાનો અભ્યાસ હાયલ કરવામાં આવેલ છે. જૈન શ્રીમતોના સમયાનુસારી એડ્યુકેશન ( Education ) તરફના દિશિબિંહુ ( Point of view ) માટે અનેકશા: ધન્યવાહ ધરે છે.

જૈન સેનેટરી એસેસરીએશન મુંઅધ્યની આરોગ્ય પ્રચાર કમીટી તરફથી માતા તથા ખાળકોનાં ભલાં માટે ભાગદિત પત્રિકા નીકળી છે; પરંતુ સહરણ કમીટીનો આ પ્રયત્ન હજુ તદ્દન તે દિશામાં અલ્પ છે. આવી અનેક પત્રિકાઓનું આરોગ્ય સંબંધમાં વખતો-વખત પ્રકાશન થાણું જરૂરી છે અને એ પ્રચારકાર્ય થાય ત્યારેજ જૈનોતું જીવન

## श्री आत्मानंह प्रकाशः।

आत्यारे डॉक्टरो अने हवाओने पराधीन थध रुद्धुं छे तेमां समजपूर्वक पवयो थध कुहरती ( Natural ) ज्ञवन ज्ञवानी तैयारी जैनसमाजमां प्रकटी शडे.

प्रालीताण्णा जैन गुड्हुणमां गत वर्षना द्वि अपाउ भासमां नवां नवां मझनोनां नामाभिधान भड्हेत्सवो भेणावडो करवामां आयो दतो प्रस्तुत गुड्हुणनी संस्थाने मुनि श्री चारित्रिविजयज्ञ कुच्छीअे पाहशाणाना आकारमां जन्म आयो पछी ते संस्थानो विकास सुंभध अने भावनगरन डमीरीना कार्यवालडो अनेकगणु वधारी शक्या छे. आ संस्थानी व्यवहारिक तेमज धार्मिक संगीन भीक्षणी ( Motive power ) ना परिणामे होइसो जेटला विद्यार्थीया लाल से छे; तेवी अन्य संस्था भाग्येज इरो. आ रीते संस्थाना कार्यवालडो तन मन अने धननो भोग आपी उक्त संस्थानी प्रगति ( evolution ) करी रखा छे. आ वर्खते भेणावडाना प्रभुभ श्रीसुत रेणुष्ठाइबाई दायर्यंह भातीयंह ज्वेरीनुं भाष्य तेमज शेठ ज्ञवण्णयंह धरमयंहनुं गुड्हुणनी डमीरीना प्रभुभ तरडिनुं भाष्य भनन करवा लायक अविष्यकालीन उच्च भावनाभय अने प्रेरक शक्तिवाणुं लहु. अनेक रथो आवां गुड्हुणो जैन समाजना उद्धारार्थे रथापवानी आवश्यकता उपर अमो सविशेष भार मुक्तीअे धीये.

आ प्रसंगे गत वर्षमां उपाध्याय श्री सुमतिविजयज्ञ, पं. सुंदरविजयज्ञ तथा पं. भातीविजयज्ञ विजेरे सहगुड्होनो स्वर्गवास तथा आ सलाना अंगभूत सलासदो वहेरा गारधरबाई गोरधनदास, डुर्लभज्ञ कल्याण्णु पारेभ, शा. ज्वेरयंह भगनलाल, सवयंह छगनलाल विजेरेना भूत्युनी दीक्षिती पुरःसर नांध लेवामां आवे छे.

आपाउ भासमां शेठ गोवींदज्ञ भुशालनुं आकर्षिमक रीते वेरावणना मुसलमानो तर-इथी छरीथी थेला युनथी थम्बेलुं अवसान ए धाणी ऐद्धनक धीना छे, जहेर संस्थानोना आगेवान कार्यकर्ता अने गीरनारज्ञ ज्ञेणुक्षारमां तन मन अने धनथी अय भाग केनारा तेव्वो लहा. एमना भूत्युथी जैन समाजने एक जैन रतनी भेणी ज्ञाट पडी छे; अपितव्यता अगवान छे, दिंहुत्व जगववानी आतर मुसलमानो तरक्थी तेमनो भोग केवाये छे; सहगतना आत्माने अमो शांति ध्येयी धीये.

प्रस्तुत भासिके गतवर्षमां गद्य अने पद्य लेखो भणीने लगभग सठसठ लेखो आपेक्षा छे. तेमां रउ पद्य लेखो छे अने ४४ गद्य लेखो छे. पद्य लेखो मां लगभग आठ लेखो संघीवी वेलचंह धनलुना छे. ज्ञेयानी कविताएो झुह्य-गुञ्जन अने संध्यातरंग विजेरे रसिक समयोग्यता काव्यनी उत्पादक अने ओधक छे. रा. छगनलाल नहानयंह नाण्णावटीनां काव्यो भणु सुंहर अने लालित्य-थी भरपूर छे. अने 'अनेड' नी कवितामां तो धीमांत अने सौलाज्यवांत विजेरेनो ढीक भेण साध्यो छे. रा. अभिलाषीना तथा रा. ज्वेरयंह छगनलालनां पद्यो वैराज्य अने अल्यासने उत्तेजनारां छे; सहगत आ. श्री अजितसागर-सूरि के ज्ञेयो श्री भाषांतरकार तथा स्वयंवह ( Automatic ) कवि तरिके

## नूतन वर्षानुं भांगलभय विधान।

६

सुप्रसिद्ध हुता. तेमणे श्री हेमचंद्राचार्य गुणवर्णन काव्यरूपे करेलुं ते पण  
पद्धतिभाग तरीके गतवर्धमां आवेलुं छे. न्यायतीर्थ मु. हिमांशुविजयल  
अनेकांतीचे संस्कृत भाषामां अव्याख्याय व्रत, तथा भ्रष्टुओनी स्तुतिओ. अलंकार-  
भद्र भाषामां अथित करीने मुकेली छे; वे संस्कृत भाषाना परिचितोने आस  
करीने आनंद आपवा लक्षितरस नीपनवे छे. रा. कुस्तुरसंह हेमचंद्र हेसाईचे  
पांच जिनराजनी स्तुतिनो काव्यरूपे संबंध आपेक्षा ते स्तुतिना भूमि उत्पादकमां  
काव्यरसिकता अने भाषणेने सरलताथी ऐध्यप्रहता अर्पी शके तेवी शैलि  
मालुम पडे छे. गव लेखोमां सुनिराज श्री हर्षनविजयलुना हस लेखो तीर्थ-  
कर चरित्रना छे ने भूमि सूत्रना भाषांतर रूपे होवा छता कुव्यसुष्ठोधिकामां  
आवेल चरित्रो करतां विशेष प्राश पाडे छे. तेमज तेमने ‘अस्मिता’ना लेख  
आत्मस्वतंयतुं ऐध्यप्रह शिक्षणु आपे छे. पू. समित्र कुर्पूरविजयलुना  
पांच लेखोचे प्रस्तुत मासिकने सुनिप्रसादीथी अलंकृत करेलुं छे; अने सरल  
शैलीथी वैराज्यभय शिक्षणीय प्रथांधनी पूर्ति करेली छे. सुनिश्ची ज्ञानवेज-  
यलुचे भयुत्ताना कंडालीटीकानो औतिहासिक लेख आपी जैन हर्षननी आची-  
नता पुरवार करी छे; तेमज प्राचीनता अने इतिहासमां रस लेनारने माटे सुंदर  
मार्गदर्शक छे. एक सुनिश्चीना ‘तभारी लुँदणी तमे वाचो’ विगेरे व्यव-  
हारे आध्यात्मिक सूषितमां आत्मनागृहि अडी करी वाचेकोमां वैराज्य प्रकटावी  
शके छे. सुनिश्ची ज्यांतविजयलुचे लगवान महावीर संबंधी भाषतोनो  
संबंध संक्षिप्तमां करी औतिहासिक समज (Historical reason) माटे ठीक  
प्रयास कर्यो छे. २० विकुलहास भूमियंह शाहना अगीआर लेखो जेवा के  
सेवाधर्मना भंत्रो तेमज मननुं रहस्य अने तेनुं नियंत्रण विगेरे व्यवहा-  
रमां तेमज आध्यात्मिक लुवनमां उपयोगी छे; लेखोनी भाषा शैली सरल  
अने सुंदर छे तेमज रहस्यथी लरपूर छे; श्रीयुत शंकरलाल डाह्यालाई लेखो  
पालीताणु जैन गुडकुणाना सुप्रीनेन्डन्ट छे तेमना नयरेखादर्शन, द्रव्यगुण पर्याप्त-  
विवरण विगेरे सात लेखो स्त्र॑लना विद्यार्थीनो आस करीने उपयोगी छे.  
केमडे नयो अने द्रव्य शुण पर्यायनी विकट समस्याओ सरल भाषामां उतारी  
शकया छे. आ सभाना सेफेटरी गांधी वल्लभहास त्रिभुवनहासना ‘संग्राहक’  
स्वतः तरीकेना शमुंज्यतीर्थीद्वार प्रथांध तथा अध्यात्मनिरूपणु प्रक्षोत्तर अने  
लगवान पार्श्वनाथल, पंडितवर्य श्रीवीरविजयल महाराज विगेरे सोण  
लेखोचे लिन्न भिन्न संबंधमांथी तीर्थ तेमज तत्त्वज्ञान संबंधी ठीक अज्ञवाणुं  
पाडेलुं छे. व्यव हेखो नूतन वर्षानुं भांगलभय विधान विगेरे मासिक कमीटी  
तरक्थी आवेला छे. मि. नरैतम थी. शाह जैनो, अने डेणवण्डी तथा वस्ती  
पत्रकमां जैनोनो हिस्सो विगेरे ऐ लेखो आवेला छे; वे केणवण्डी अने जैनोनी

સંખ્યા સંખ્યાંધી પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. જાતિ અને તેનો ઉદ્ઘય સંખ્યાંધી શ્રીયુત કુલ્યાણુભાઈ હર્વાલજી અવેરી થી. એ. ના પાંચ લેખો છે. તેમાંનો કેટલોક લાગ ચર્ચાસ્પદ છે તેમજ કેટલોક લાગ જાતિઓએ એક સંપૂર્ણ વધારી અનુઝળ તત્ત્વોને સ્વીકારી અપનાવી લેવા ધરે છે. રા. કેસ્ટિચયંડ હેમચયંડ દેશાઇનો ભાવનાનું બળનો લેખ લેખક તરીકેની લવિષ્યની કારડીફીના કોલ આપે છે. આ સિવાય વર્તમાન સમાચારના જાત લેખો તથા સ્વીકાર અને સમાદોયનાના આઠ લેખો આવેલા છે, તે માસિક કમીશીએ આપેલા છે. ઉપરાંત પીડિ પૃષ્ઠ ઉપર લિન્ન લિન્ન સાક્ષરેના સહૃદેશજનક વચ્ચેનો જુદ્ધ જુદ્ધ અંથોમાંથી રહુસ્ય તરીકે તારણુ કરીને બાર લેખો ભાઈ વિહુલહાસ શાહ તરફથી આપવામાં આવ્યા છે કે જે વાચક વર્ગના વિચારને સન્માર્ગમાં પ્રેરક છે. વિચારો કરતાં વર્તનની ભલત્વતા.

જેટલાં નથો તેટલાં વચ્ચેનો છે. પરંતુ એ વચ્ચેનો કરતાં કર્તાંબની કિમત અનેક ગણી વધે છે. હાન, શીલ, તપ અને ભાવ રૂપ ચૃદ્ઘનિ ધર્મમાં દાનની પ્રાથમિકતા સેવા ધર્મની મુખ્યતાને અંગે છે; ભત્યાખ કે વિચારો. કરતાં કર્તાં કરવાનો સમય આવી પહોંચ્યો છે, તે સમયે નીચેના પ્રશ્નો પ્રત્યેક મનુષ્યે પોતાના આત્માને પુષ્ટી લઈ અંતઃકરણનો ઉત્તર મેળવી લેવો જોઈએ અને કર્તાં પરાયણ થઈ જતું જોઈએ, એ પ્રશ્નો તે આ છે; મનુષ્ય કુન્ઠનું કર્તાં શું હોઈ રહે ? પશુ કોટિ કરતાં આપણી પ્રવૃત્તિ ઉચ્ચ છે કે કેમ ? બ્યવહારમાં અર્થ અને કામ ( Desire ) ની પાછળ ધર્મનું બળ છે કે કેમ ? ધર્મ અને તેના પાલનની પાછળ આત્મધળ ( Spiritual power ) ની પ્રગતિ ડેટલી છે ? વિલાસ ભાવના અને ધર્યાણ્યા પ્રથમ કરતાં વધે છે કે ધેર છે ? કોણ માન માયા અને લોબનું બળ મંદ પડતું જાય છે કે વેગવાન થતું જાય છે ? જૈન દર્શનની વિશુદ્ધ કિયાઓનું પાલન કરવામાં અવકાશ ડેટલો લેવાય છે ? પરમાત્માની અકિંતારા આત્માની પ્રસન્નતા પ્રકટે છે ? આ સર્વ પ્રશ્નો આ વર્ષને પ્રાંતે વિચારો તેમાંથી મન વચ્ચેન અને શરીરના બળવંડ આચાર ( Practice ) માં સુકી જગત ઉપર મનુષ્ય અને જૈન તરીકેના જન્મની સાર્થકતા કરવા સૂચવીએ છીએ.

## જૈન સમાજને સંચયના.

जैन दर्शन के जैन वारसामां तत्त्वार्थ सुन लेवां अंगेवुं तत्पत्रान अने कर्मअंथ जेवा अति सूक्ष्म अने तत्पत्रशी विभाग मध्या छे तेनी अभृंडता ( wholesomeness ) अने विशालता (Comprehensiveness) नहीं जणवी राखतां क्लेशना नजुवा साधनो उला करवा माटे दीक्षा विग्रे प्रश्नोने निभित आपी आपणे आपणी मारइते आपणुं अधःपतन करवा ऐहा छीमे. प्रस्तुत संकांतिकाण ( Transition period ) चाले छे; पूर्व अने पश्चिमनी संस्कृतियेतुं धर्मणु चालु छे; तेवा वाहते न्हानी न्हानी भाष- तोमां भागला पाउवानी आपणी वृत्तियेऽप्य लविष्यमां भोटामां भोटी त्रीयो गणासे;

## तूतन वर्षानुं मंगलमय विधान.

११

जैन समाज जे ज्ञवा अने जगतने उपयोगी थवा भांगते होय तो पोतामां घर करी रहेली जडताने अने संकुचितताने त्यागे अने पोताना धर्ममां रहेली विशाळतानुं अंतरावलोकन ( Introspection ) करी एवं विशाळतानुं दर्शन भानन समाजने केम थाय तेने आचारमां मुक्खानो प्रथत्न करे; तेमज अंदर अंदर अराखर सुगहित अनी हेसकाणानुसार पोताना उत्कर्षना उपाय पोते योगे; जे जैन दृष्टि जगतनी विकट समस्याओं उडेलवामां उपयोगी नीवडे तेम छे ते दृष्टि आगे जैन समाजना अति कुछ विवाहमां एटली अधी मुंजाइ पडी छे के एक तरइ जगतना भदा प्रश्नो अने भीज तरइ जैन जगतना गृहविवाह मुझी सरभाभणी करीए तो आपणे तुलना दृष्टि ( Comparative point of view ) गुमानी ऐहा छीए अने जैन दर्शन इप अमूल्य भिणुनो काचना कटकातरीक उपयोग आपणे वर्ज्युक्त शुद्धि होवा छतां करी रखा छीए. यंगमेन्स सोसाईटी अने जैन कॉन्सर्न्स उल्य पक्षे भणाने हाथालाच भीकाववा नेइए अने रचनात्मक कार्य ( Constructive work ) मां लागी जनुं जेइए.

जे के अभो अद्वावाही छीए अने धृच्छीए छीए के उल्य पक्षो सम्भित थध जैन धर्मनी अभांडता इपे संप साधरो ज अने ते शुल दिवस वहेको आवे तेवी अधिकायक देव पासे प्रार्थना करीए छीए अने तेवी धृच्छा साथे रचनात्मक कार्य प्रस्तुत वर्षने माटे नीये प्रमाणे जैन समाज समक्ष सादर उपरिथित करीए छीए.

(१) श्री भाऊवीर चरित्र, धृतिहास साहित्य अने विशाननी तुलनात्मक दृष्टिए तमाम प्रसंगो साथे तैयार करवानी आवश्यकता.

(२) जैन दर्शनानुं तत्त्वज्ञान आधुनिक विज्ञानवाद ( science ) साथे अनेक रीते अंधेसतुं छे, तेनुं पृथक्करणु करी अत्यार सुधीमां थेली विज्ञानवाहनी शोध साथे समन्वय करी ‘वैज्ञानिक जैनधर्म’ ना पुस्तकइपे तैयार करवानी जडीआत.

(३) स्वपर रक्षणु अर्थे तेमज शरीरभण अने भनोभण ( will power ) नी तेमज अद्वायर्थनी शदआतथी ज भज्युती अर्थे तैयार थवा व्यायामशाणाओ स्थणे स्थणे स्थापवी.

(४) जैन साहित्य परिषद जेवी संस्था उभी करी तेनी नियमित बेठके भरी जैन साहित्यने विपुल प्रमाणुमां-समयने अनुकूल रीते-लाधाना वाहनमां तैयार कराववुं.

(५) जैन कुथानुयोगमां भूतकाणना गैरवतुं लान करावती औतिहासिक नवलकथाओ नूतन पद्धतिपुरःसर कमशः प्रसिद्ध कराववी.

(६) जैन शिक्षणुमाणा जेवी एकाह छारमाणानी योजना ( Design ) करवी; जेमां धार्मिक विषयो शिक्षणुनी छेष्टामां छेष्टी पद्धतिए शीघ्रवामां

આવે; એની ચઢ ઉત્તર એવી યોજના કરવામાં આવે કે નવ વર્ષની ઉમ્મરતું ખાળી એ પુસ્તકોક્ષારાજ જૈન ધર્મનું સંગીન જ્ઞાન પ્રાપ્ત કરી લે અને પૂરેપુરં સહાયારવાળું બને.

(૭) જૈન ધાર્મિક જ્ઞાન સીરીઝ, ગુરુકૃપામાં, એઈજોમાં અને વિદ્યાલય તેમજ પાઠશાળામાં એકજ ડેર્સ તરીકે જુદી જુદી પદ્ધતિએ તૈયાર થાય અને તે અધિક હિંદુત્વાનમાં ‘એક સીરીઝ’ તરીકે પ્રચાર ખામે, જેથી જુદે જુદે સ્થળે થતા જુદા જુદા અભ્યાસોથી થતી નકારી શક્તિઓનો વ્યય અટકે. ( શ્રી એન્ઝ્યુકેશન એડને આ ખાખત ધ્યાન પર લેવા સૂચના છે. )

(૮) કુદરતી ઉપચારો ( Naturopathy ) થી હરદી સારાં થઈ શકે તેવા સેનેટેરીયમની યોજના અને પત્રિકા પ્રચારની યોજના.

(૯) જ્ઞાનપંચમી જેવા પવિત્ર દિવસોએ જૈન સાહિત્યના પ્રદર્શનો યોજવાં.

આ રીતે અમ્ભો આશા રાખીએ છીએ કે જૈન સમાજ અખંડ અને અવિલક્ત અની સમાજના હિત માટે રચનાત્મક કાર્યોમાં તૈયાર થાય અને શાંતિ, સમાધાની, મૈત્રી અને કલ્યાણનો સંદેશ જીવે અને જીવાવે.

**નવીન ભાવના અને લેખકોનો આભાર.**

પ્રસ્તુત નવીન વર્ષમાં ધર્મજીવનમાં ખળની પ્રગતિ થાય તેવી સુંદર શૈલિથી લેખો આપવા ધર્છા રાખેલી છે; ડેળવણીની પ્રગતિ અને ટેવચુર ધર્મની અધ્યાત્મા વિશેપ અમાણુમાં પ્રકટી આત્માનુભવની ઝાંખી થાય તેવા હેતુપુરઃસર નવીન વર્ષમાં લેખો આપશે; આ અમારી ભાવનાની સફળતા સાક્ષર લેખકોના ઉપર નિર્ભર છે.

પાંતે પૂન્ય મુનિશ્રી લેખકોનો તેમજ સાક્ષર ગૃહસ્થ લેખકોનો પ્રસ્તુત પત્ર સાથે સહાનુભૂતિ ધરાવનાર તરીકે આભાર માનીએ છીએ, તેમજ નવીન વર્ષમાં અમારી ભાવનાને વિશેપ બળ મળે તેવી વિચાર પ્રણાલિકાને લાંબાની જૈન સમાજને વિશેપ ઉપરોગી લેખો આપવા સાહિર નિમંત્તીએ છીએ.

નવીન ભાવનામાં-કેટલાક આટપટા સંન્દેશો વરચ્ચે-ચાચા સભાની રથાપનાને પાંતીશ વર્ષો થઈ ગયા છતાં-દ્રાઘ મહોત્સવ ઉજવવાનો સભાએ ફરાવ કરેલ હોવા છતાં—ઉજવી શકાયો નથી; પરંતુ સભાના કાર્યવાહકો આ લક્ષીકત વહેલી તક લથ્યમાં લેશો કે જેથી ગુરુભક્તિ, જાનોદ્ધાર, સાધિત્ય પ્રચાર અને સમાજસેવા વિગેરનો સંપૂર્ણ હેવાલ તે નિમિત્ત પ્રકટ કરવાનું અનશે. વિવિધ સાહિત્ય પ્રચાર-કાંકન અને સસ્તું સાધિત્ય એ સભાનો ઉદેશ ચાલુ રહેલ છે; અને એટલાજ માટે સીરીઝના અંથોની યોજના સભાએ કરેલ છે. પ્રાચીનતમ કથાનુયોગનો અંથ વસુહેવલિડીના પ્રથમ ભાગનું પ્રકાશન થઈ ગયેલું છે; દવે બીજે ભાગ તેમજ અન્ય પ્રાચીન સાહિત્ય બનતી તાકીદે પ્રકટ કરવાની તૈયારી ચાલે છે.

## जूतन वर्षातुं मंगलमय विद्यान.

१३

### आगामी शांतिकाणनी सहित्य।

समय हिंदुस्तानमां संकान्तिकाणना प्रयांड मेजांचो वडेवां लाभ्यां छे; महात्मा गांधीजुचो अभिल हिंदुस्तानने अहिंसाना संवेदशक्तारा सत्याग्रह अने स्विनिय लंगतुं शिक्षणु आपी गत वर्षमां लाडी, लेल, विगेचे लोगो। प्रजाने भरलुआतपणे हिंमतपूर्वक अपावी अभिल हिंदुस्तानने संगठित करेलुं छे; हवे तेच्याश्री राऊड टेब्ल औन्हरन्समां हिंदुस्तान माटे स्वतंत्रतानुं सत्त्व मेगववा केंब्रिस तरक्थी विलायत ज्वा स्टीमरमां उपडवानी तैयारीमां छे; एवा प्रसंगे आपणे विश्वासपूर्वक आशा राखीचे छीचे के तेच्या हिंदु-मुसलमानोनी एकसंघी मेणवी लाई विलायतथी हिंदुस्तान माटे स्वातंत्र्य-सत्त्व लाईने सुअशांतिपूर्वक जल्दी आवे. तेथी हिंदुस्ताननी प्रजातुं हृदय सरकार तरक्त आजसुधीमां के हालक्लेला थर्ड रहेलुं छे ते स्थिर अने शांत थाय, एकारी धटे, अर्थिक परिस्थिति सुधरे अने हिंदुस्तान पोताना पग उपर उलुं रही गौरवपूर्वक घीज स्वतंत्र देशोनी हरेणमां उलुं रहे अने पोते पोतानुं चलावी शकवा अनेक दृष्टिहुच्याथी समृद्ध अने तेमज शांति-पूर्वक धर्मपालन निर्भयपणे करी शके।

### अंतिम ग्रार्थना।

जूवन चे मात्र कालप्रवाहमां तथातुं काष्ठ नसी, पणु कालने पणु वशमां क्षेत्रुं चैतन्य शक्तिनो आविर्भाव छे. तेथी जूवन चे Drift नहिं पणु art; तेमज artificially पणु नहिं; अर्थात्-चैतन्य शक्तिथी प्रकट थती एक सुंदर कणा छावी लेईचे. चे कणा प्रत्येक वाचक प्राप्त करो-चे आशा साथे उपसंहारमां रउ मा तीर्थं कर श्री पार्वतीनाथलु महाराज अने उपसर्ग हुरनारा तेमना अधिष्ठायक पार्वतीक्षनुं मंगलमय स्मरणु करी नवीन वर्षमां तेच्या प्रस्तुत पत्रना वांचको माटे एवुं साहित्य उपज्ञवे के के वांचकोना जूवनमां रसपूर्ति करे, नेत्रोमां ज्ञानज्ञयेति लरे, युद्धिमां विवेक पूरे, हृदयमां श्रद्धानो लंडार लरे, समस्त जूवननी परमात्मा साथे असेह एकाशता (Concentration) करवे अने भूर्त्तिमान् आनंद उत्पन्न करी नवयेतना प्रकटवे चे मंगलमय ग्रार्थना साथे नीचेनो स्तुति श्वेष कावेजी विरभीचे छीचे।

भक्त कामित कल्पद्रुः प्रत्यूह व्यूह नाशनः ।

त्रैलोक्याद्वैतमाहात्म्यः श्री पार्वतीः पातु नः सदा ॥

ॐ शांतिः



# મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ.

( ગતાંક પૃષ્ઠ ર૧૮ થી શરી )

## અનુ૦—વિઠુલહાસ મ્રી. શાહ.

અહુંકાર મનતું બીજ છે અને યુદ્ધિ અહુંકારનો આધાર છે. યુદ્ધિ વિ-  
શિષ્ટ આત્મા જ અહુંકાર છે.

સંયુક્ત સંકલન અને પ્રજા જ સંખ્યદર્શન કહે છે કે અધિકું સ્વરૂપ છે.

જેવી રીતે એક પાંજરામાં પુરેલો સિંહ તેના સણીયા તોડીને બહાર નીકળી આવે છે તેવી રીતે જાની પુરુષ આ બૈતિક શરીરકૃપી પાંજરામાંથી સતત વિચાર ( આત્મ-જીવાસ્ત્વ ) નિરંતર નિહિદ્ધાસન તથા અધ્યાત્માવના ક્ષારા વિજય પ્રાપ્ત કરીને બહાર નીકળે છે.

એક વાર મન શરીરમાંથી નીકળી ગયું અને એક વર્ષ સુધી બહાર રહીને પાછું આવી શરીરના ભીજા અવયવોને પૂછવા લાગ્યું કે મારી વગર તમે કેવી રીતે રહ્યા ? તેઓએ જવાબ આપ્યો. તે જેવી રીતે એક બાળક માનસિક શક્તિ વગર પ્રાણુથી શ્વાસ લે છે, વાણીથી બાલે છે, તેનાથી જીવે છે, કાનથી સાંસલે છે તેવી રીતે મનની કિયાએ પ્રાણુધીન છે. પ્રાણુ અથવા જીવનમાંથી જ સધ્યું ઉત્પન્ન થાય છે.

દ્યાનમાં વાસનાઓજ બાધક બને છે. બધી છુપી વાસનાઓને સંકલ્પ તથા વિચારક્ષાર વર્ણિકૃત કરવી જોઈએ.

કામ-વાસના અને તૃપણું એ બેઝ ધ્યાનમાં મહાન વિધન ઉપસ્થિત કરનાર છે. તક ભળતાં જ તેમાં આડમણુ કરી યોસે છે. તેઓ સાધક ઉપર વારંવાર ચઢાઈ કરે છે. મહાન પ્રયત્ન, વિચાર, આત્માનાત્મ વિવેક અને શુલ્ક કાવના દ્વારા તેને નિર્મૂળ કરી નાંખવી જોઈએ.

દ્વારાનાં ખીલાં વિધું તન્દ્રા, આળસ્ય, માનસિક ઉત્સેજન, મનની ચંચણતા તથા ઉદ્દેશ છે. તંદ્રા તથા આલસ્ય પ્રાણુયામ, શીર્ષસન, સર્વાંગાસન, ભયુરાસન તથા અદ્વય લોજનવડે હુર કરી શકાય છે. બાધાઓ શોધી શોધીને હુર કરતા રહેયું જોઈએ. એ લોકો બાધક જ્ઞાનાય તેવાઓનો સહવાસ તજવો જોઈએ. જોઠા તર્ક કે વિવાહ ન કરે. યુદ્ધ વગરના મૂઢમતિ માણુસોને સમજવાનો પ્રયત્ન ન કરે. મિત્રાખી બનો, મૈન સાધન કરો, અને એકાંત

## મનતું રહેસ્યો.

૧૫

સેવન કરો. તમે સર્વ પ્રકારની ઉત્તેજનાએથી બચી શકો છો. હુમેશાં સત્તસંગ કરો. સત્તશાસ્ત્રોનો સ્વાધ્યાય કરો, ઉન્ન્ય ભાવના રાખો, અર્થ અને ભાવના સહિત આંકારનો જ્યો કરો. બધાએ કુવિચાર આપોઆપ નષ્ટ થઈ જશો.

વાણીના મૈન કરતાં મનતું મૈન ધણે દરજનજે સારું છે. મૌનની પ્રવૃત્તિ આપોઆપ સ્વાભાવિક રીતે જ થવી જોઈએ. મૈન માટે બળપૂર્વક પ્રવૃત્ત થણું એ તો કેવળ મનની સાથે ચુદ્ધ કરવા જેવું છે. એ તો એક પ્રકારની કસરત છે. જો તમે સત્તયને વળણી રહેશો તો મૈન પોતાની મેળેજ આવી જશો, અને ત્યારે જ અક્ષય શાંતિ પ્રાપ્ત થશો.

જ્યારે મનોવિકાર અને વાસ્નાએ તમને ઉદ્દિષ્ટ કરે ત્યારે તમારે તેનાથી ઉદ્દાસીન થઈ જવું જોઈએ, અને ચિંતન કરવું જોઈએ કે હું કોણ છું? હું મન નથી, હું આત્મા છું, ચુદ્ધ સચ્ચિદાનંહ છું, તો પણી મનોવિકાર મને કેવી રીતે પરાજિત કરી શકે છે? હું નિર્દ્દિષ્ટ છું, હું આ મનોવિકારનો સાક્ષી છું, મને કોઈપણ અડચણું નથી કરી શકતું. ” જો તમે આવા પ્રકારના વિચારો વારંવાર કરશો તો મનોવિકાર આપોઆપ નષ્ટ થઈ જશો. આ જ્ઞાન-કિયા મનોવિકારને વશીકૂત કરવામાં જેટલી સરળ અને સહેલી છે તેટલી ચિત્તરવૃત્તિઓના વિરોધરૂપ યોગકિયા નથી. મનની સાથે દ્રંઢ ચુદ્ધ ન મચાવો. એનાથી શક્તિનો નકામો હુસ થાય છે. એનાથી સંકદ્વય શક્તિ નથણી પડી જય છે. સત્તયમાં નિવાસ કરો. ઝેમાં વિચારો. વિચાર, સહભાવના અને નિહંદ્યાસન દ્વારા આત્મામાં રમણું કરો. બધાએ વિદ્ધો, અશુલ નિયમો, મનોવિકાર આપોઆપ હુર થઈ જશો. આ વિચાર-પદ્ધતિની ઉપયોગિતાનો અનુભબ કરો, તેને માટે પ્રયત્ન કરો, અભ્યાસ કરો, અને મનન કરો.

વિષયાત્મ ( Subjective mind ) વાસ્નાત્મક ( Subconscious mind ) કારણુત્મક ( Unconscious mind ) મન તથા ચિત્ત-એ બધા પર્યાયવાચી છે. જુદા જુદા થંથકારો જુદા જુદા શાણ્હોનો ઉપયોગ કરે છે. એનાથી ન ગભરાએ. એ તો કેવળ શાણ્હણળ છે.

વિષયાકાર મન અને પ્રયુદ્ધ મન પર્યાયવાચી શાણ્હો છે. વિષયાકાર મન દ્વારા જ આપણે દેખીએ છીએ, સાંભળીએ છીએ અને શીખીએ છીએ.

સમાધિ ચિત્ત, આધ્યાત્મિક ચિત્ત, અનાત્મ ચિત્ત અને સાર્વલૈલ ચિત્ત, પર્યાયવાચી છે. એનાથી ન ગભરાએ.

જ્યારે ચિત્તમાં શાંતિ થાય છે અને સર્વ પ્રકારના લોગો પ્રત્યે વિરક્તિ થાય છે, જ્યારે શક્તિશાળી ઇન્દ્રિયો અંતર્મુખ બને છે અને અજ્ઞાનનો નાશ

થઈ જય છે, ત્યારે સહિતુનો સહૃપદેશ શિધ્યના હૃદયમાં પ્રવેશ કરીને વિકસિત અને છે.

તરે હિમાલયનો ગુફામાં રહેા કે શહેરમાં રહેા, ગમે ત્યાં રહેા, પણ તમારું ચિત્ત સ્થિર નથી હોતું તો તમારા માટે જન્મે સમાન છે. તરે ઘણે હુર નિર્જન ગુફામાં ચાહ્યા જાયો તોપણું તમારા પોતાના વિચારો તમારી સાથે જ આવશે, કેમકે મન તો તેજ રહેવાનું. શાંતિ તો અંહરથી આવે છે. ઉદ્દેશ, કોધ, અસરોષ, પ્રતિહિંસાનો ભાવ, સહેલ, પક્ષપાત, ધર્યો, દ્રેપ, અસહિપણુતા, ઉત્તેજના, વ્યાકુળતા, વિષાદ, પ્રભૂદિત મનોરાગ,-એ સર્વને આધ્યાત્મિક સાધના દ્વારા, સત્ત્વશુણુના ઉત્કર્ષ દ્વારા, ઓંકારના ધ્યાન દ્વારા અને હમેશાં વિચાર દ્વારા સમૂળગાં નષ્ટ કરી હેવા જેધાં. ત્યારેજ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે.

મન અનેક જન્મોમાં ઉત્પન્ન થયેલી વાસનાઓએ સિવાય કશું નથી. જેએઓએ આત્માનુભવ કરી લીધો છે, તેઓની શુદ્ધ વાસનાઓએ પુનર્જન્મનું કારણ નથી થઈ શકતી. એ પ્રકારનું ચિત્ત સાત્ત્વિક કહેવાય છે, પરંતુ જ્ઞાનહીન ચિત્ત સાધારણ રીતે મન જ કહેવાય છે. જ્ઞાનમય ચિત્ત તો પોતે જ સત્ત્વ છે, પરંતુ જ્ઞાન વગરનો પુરુષ તો પોતાના મનથી સર્કેત કરેલા માર્ગ જ ચાલે છે.

મન કાં તો ચિન્તન, મનન, અનુભવ અને જ્ઞાન સંપાદન કરતું રહે છે. અને કાં તો સંકલ્પ કરે છે, તમારે સ્વતંત્ર અંનાર્દીદ્વારા એટલું જાણુતા રહેવાની જરૂર છે કે અમુક સમયે મન ખરેખરી રીતે શું કરી રહ્યું છે. એનો અભ્યાસ કરવા માટે એક સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે. ઉત્તમ અંધોના અભ્યાસથી, સત્ત્વંગથી, ધર્નિદ્રય નિયંત્રણથી તથા સાત્ત્વિક આહારથી બુદ્ધિ અતિસૂક્ષ્મ બનાવી શકાય છે.

આધ્યાત્મક સાધનાનું તત્ત્વ જાણી લેવાની જરૂર છે. મનમાં એ દોષ હોય છે. રાગ અને દ્રેપ, એ બન્નેએ તમને મનુષ્ય બનાવ્યા છે. અંધતું સ્વરૂપ પણ એ રાગ અને દ્રેપ જ છે. એ જ રાગદ્રેપ અશાનનું સ્વરૂપ છે. વિચાર તથા સહભાવનાવડે એને નિર્મૂલ કરી હો. બસ, પછી તરે આલ્ફાર્થી હેઠાયુનાન થઈને ઉઠશો.

ભાવના જગતની અને મનુષ્યની સૃષ્ટિ કરે છે. અને એ ભાવના જ તેનાથી વિપરીત સહભાવના થવાથી મનુષ્યને ધર્નિદ્રય-સુખ તથા લૌતિક ભાવનાઓથી મુક્ત કરી હે છે.

વાધ એક વખત મનુષ્યતું બોણી ચાંચે છે, પછી તે હમેશાં મનુષ્યોને મારવાની તક શોધતો લમે છે. તે મનુષ્ય-લક્ષી થઈ જય છે, એવી જ રીતે

## મનતું રહેસ્યો.

૧૭

મન એક વખત વિષય-સુખનો આસ્વાહન કરે છે, તો તે વિષયની પાછળ જ દોડયા કરે છે. સરતત સહૃદિયાર તથા સહૃદાવનાઓએ વડે જ મનને વાસનાત્મક વિશ્વારો તથા દોષાવનારી પ્રાકૃતિયાથી પાછા હડાવી શકાય છે. માનસિક ભાવનાઓએ ફરી ફરી જગાડીને મનને સમજાવો કે ઈન્દ્રિય-સુખ મિશ્યા છે, બ્યર્થ છે, માયામય છે અને કષ્ટપ્રદ છે. મનની સમજ્ઞ આધ્યાત્મિક જીવનના લાભ, આનંદ, શક્તિ તથા જીવન ઉપસ્થિત કરી તેને સમજાવો કે ઉચ્ચત અને નિષ્ઠ જીવન અમર આત્મામાં રહેલું છે. જ્યારે મન એ પ્રકારનો ઉપયોગી ઉપદેશ સાંસલે છે ત્યારે તે પોતાનો જુનો અસ્યાસ તજી હે છે.

નાસિકા સાત્ત્વિક અંશમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તે આધી તુકશાન-કાર્યક છે. ગ્રાણ્યુનિદ્રિય અને ગ્રાણુતન્તુ તમને વધારે ઉદ્દ્ઘિન નથી કરતા. તેઓને ધણ્ણીજ સહેલાધીથી વશ કરી શકાય છે.

જીબા તથા ઉપસ્થ જલ-તન્માત્રાથી ઉત્પન્ન થાય છે. એ બન્ને ફેનો છે. આહાર ( રસના ) બીજુ ઈન્દ્રિયોને દશ કરે છે. જે તમે રસનેનિદ્રિય (જીબ) ને વશ કરી શકશો તો બાકીની ઈન્દ્રિયોને તમે ધણ્ણી જ સહેલાધીથી વશ કરી શકશો. સૌથી વધારે બાધક ઈન્દ્રિય ઉપસ્થ છે. તે પછી બીજો નંબર જીબનો છે, પછી વાણીનો, તે પછી કાનનો અને છેલ્દો આંખનો.

આંખ તથા પગ તૈજસ-તન્માત્રાના બનેલા છે. એ બન્ને ઈન્દ્રિયો ફેનો છે. આંખ દૃશ્ય વસ્તુ જેવા ઈંછે છે અને પગ કહે છે કે ‘હું તને તીર્થસ્થાનોમાં લઈ જવા તૈયાર છું, મારે ચાલો.’

આમણી અને હાથ વાયુ-તન્માત્રાના બનેલા છે. એ બન્ને પણ ફેનો છે. આમણી કહે છે કે ‘હું રેશમી ડોમળ વસ્તો પહેરવાનું સુખ લોગવવા ઈચ્છું છું’ હાથ જવાખ આપે છે કે “જીબાલી ફેન, સુંઝાઓ મા, હું તમારા માટે સુંદર સુંવાળું રેશમ લાવી આપીશ.”

વાણી અને કાન એક જ આકાશ-તન્માત્રાથી ઉત્પન્ન થયેલા છે. એ ઈન્દ્રિયો પણ એક માની દીકરી છે. એ પોતાના પ્રાકૃતિક કાર્ય નિર્વાહમાં એક બીજાને મહાદ આપે છે.

મન અને ઈન્દ્રિયો જીબા જ છે. પણ મનતું વિશદીકરણ ઈન્દ્રિયોમાં થાય છે, મન ઈન્દ્રિયયુક્ત પુરૂષ છે. ધનીભૂત ઈન્દ્રિયો જ મન છે. ઈન્દ્રિયો મનની બ્યક્તા-વરથાઓએ છે, તેઓ મનના સ્વરૂપની જ અભિવ્યંજીકા છે. મનમાં આસ્વાહનની અભિવાધા જીબ, દાંત તથા પેટના રૂપમાં બ્યક્ત થાય છે. મનમાં જ્યાલવાની ઈચ્છા પગના રૂપમાં પ્રકટ થાય છે. જે તમે મન વશ કરી શકો તો ઈન્દ્રિયોને

પણ વશ કરી શકો છો અને લે તમે ઈન્દ્રિય-નિબ્રહુ કરી લીધો હોય તો પછી મનને વશ કરવાનું આજી નથી રહેતું. સમુદ્ર નવીઓદ્વારા પોતાનું જીવન ધારણું કરે છે, નહીંઓ. વગર તેનું અતિસ્ત્રવ જ નથી હોઈ શકતું. એવી રીતે મન સમુદ્ર છે જે ઈન્દ્રિયોરૂપી નવીઓદ્વારા પોતાનું જીવન ધારણું કરે છે. મન-સમુદ્ર ઈન્દ્રિય-નવી વગર જીવન નથી શકતું.

જનનેનિદ્રિયની અપેક્ષાએ રસનેનિદ્રિયને વશ કરવી વધારે કઢિન છે, કેમકે તમે જન્મથી જ જાતનાતના લોજનનો આરવાહન કરી રહ્યા છો. ડામવાસના ધર્ષે ભાગે ૧૮ વર્ષસની અવરસ્થા પહેલાં પૂર્ણપણે બ્યક્ત નથી થતી, અત્યેક જન્મમાં તમે ડામવાસનાનો ઉપસોગ અસુક જ વઅત કરી શકો છો, પણ લોજનનું આરવાહન તો તમે છેવટ વૃદ્ધાવરસ્થામાં પણ કરો છો. રસનેનિદ્રિયનો નિબ્રહુ કરવાથી અધી ઈન્દ્રિયો વશ થઈ જાય છે. નાચ, ગાન, સિનેમા અને દર્શ્યો જોવાનો ઉપસોગ કેવળ મનુષ્ય જીવનમાં જ થઈ શકે છે. પણુપક્ષીઓ સિનેમાના દર્શ્યોથી આનંદ નથી પામતા. રસનેનિદ્રિય જેટલી જળવાન ચક્ષુ-ઇન્દ્રિય નથી હોતી.

જ્યારે મન ધ્યાનના એક જ લક્ષ્યમાં પૂર્ણપણે નિમચ થઈ જાય છે ત્યારે તેને સમાધિ કહે છે. મન પોતેજ ધ્યાનાડાર-વૃત્તિની સાથે તરુફ બની જાય છે. ધ્યાતા અને ધ્યેય, દૃષ્ટા અને દૃશ્ય, સેવક અને સેવ્ય એક તેમજ તરુફ બની જાય છે. મન પોતાપણું ભૂલી જાય છે, અને ધ્યેયની સાથે એકા-કાર થઈ જાય છે.

જ્યારે મન ઈન્દ્રિયોથી વિચિન્ન થઈ જાય છે ત્યારે માનસ-પ્રત્યાહારની શરૂઆત થાય છે, જ્યારે ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોથી હડાવી બેવામાં આવે છે ત્યારે ઈન્દ્રિય પ્રત્યાહાર થાય છે. પ્રત્યાહાર એક બ્યાપક શાખા છે, જેમાં ‘હમ’ નો પણ સમાવેશ થઈ જાય છે. હમનું પરિણામ પ્રત્યાહાર છે.

વાસના વગર પ્રવૃત્ત થયેલ મનની શાંતિને શરૂ કહે છે.

સન્યાસ કેવળ એક માનસિક સ્થિતિ છે. ઝૂફ્યને ગેરૂ રંગથી રંગવું એજ સન્યાસ છે, નહિં કે વખ્તને. એજ વસ્તુતા: સન્યાસી છે કે જે સર્વ પ્રકારની વાસના તથા અહંકારથી છુટી જાય છે અને સર્વ પ્રકારના સાત્ત્વિક ગુણોથી પૂર્ણ હોય છે, પછી લક્ષે તે સંસારમાં પારિવારિક જીવન બ્યતીત કરતો હોય. જે સન્યાસી જગતમાં રહે છે પરંતુ વાસનાઓથી પૂર્ણ હોય છે તે વાસ્તવિક રીતે ગૃહસ્થ છે અને વિપ્યવાસનામાં પહેલો એક મૂઠ છે. ઘણું મનુષ્યો નથી સમજતા કે સાચો ત્યાગ શી વસ્તુ છે. સાચા ત્યાગનો અર્થ એ છે કે અધી

## संपादकनुं कर्तव्य.

१६

કામના, ટૃપ્ણા, વાસના તથા અહંકારનો ત્યાગ કરી હેવો. જે તમારું મન નિષ્કદંદ છે, અનાસંક્રત છે, અનહંકારી અને વાસનારહિત છે તો તમે સાચા સન્યાસી છો, લખે તમે જગતમાં રહેતા હો અથવા નગરના ડેલાહલમાં રહેતા હો; લખે તમે માશું સુંડાવી નાઓ કે વળ વધારે રાખો.

ગનને એક ન ગમે તેવું કામ આપો તો તે વિદ્રોહ કરશો. તેને સમજવો, પછી તે આજાનુવર્તન કરશો. —ચાલુ

\* संપादकनुं कर्तव्य.

( અનુવાદ—ગાંધી )

આજકાલ જ્યાં જ્યાં દૃષ્ટિપાત કરીયે છીયે ત્યાં ત્યાં જું વાહ પત્રો, માસિકપત્રો તેમજ નાના મોટા પ્રકાશિત અંશોનો મોટા પ્રમાણુમાં પ્રચાર થતો જેવામાં આવે છે. દૈનિક, સાયાહિક, પાલ્શિક, માસિક, વૈમાસિક વગેરે સર્વ પ્રકારના સામયિક સાહિત્ય પત્રો ભારતના પ્રાચીન સર્વ પ્રાંતોમાં પ્રકાશિત થઈ રહેલ છે. અજૈન સામયિક અને સ્થાયી સાહિત્યની તો ગણ્યના થલી કઠીન છે, પરંતુ પ્રાકૃત, સંસ્કૃત, શુજરાતી, હિંદુ આદિ ભાષાઓમાં પ્રકાશિત જૈન અંશો અને સાહિત્ય પત્રોની સંખ્યાપણું પ્રતિહિન વધતી જાય છે. પરંતુ અનુભવસિદ્ધ એ વાત છે કે થોડા એક સુંઘ્રાખલિત કાર્ય બહુ રીતે શુંખલા વિહિન તેમજ સનુઠી કાર્યથી કંઈ ઢીક થાય છે, જેથી કેઈ કેઈ વખત યથાવત્ત ન કરવાથી કામતું થવું તે નહિ થવા જેવું થાય છે. જેથી તેવું કેઈ પુસ્તક અશુદ્ધ અથવા નષ્ટભ્રष્ટ સંસ્કરણ નિદ્રાનોની દૃષ્ટિમાં બહુજ દોષનિક થાય છે. સાહિત્યના અંશોના સંપાદન માટે લારે શક્તિતશાલી હાથો અને દ્વયુત્પત્ત મસ્તિષ્કની આવશ્યકતા હોય છે. સંપાદનના કાર્યને અમો એ ભાગમાં વહેંચણી કરીયે છીયે.

(૧) અથ સંપાદન. (૨) સામયિક પત્ર સંપાદન.

સર્વ પ્રકારના સાહિત્ય પ્રચારના કાર્યમાં પ્રાચીન સાહિત્યનું સંપાદન કાર્ય વિશેષ કઠીન છે. પ્રાચીન સાહિત્યના પ્રચારને માટે સંપાદકોને પ્રથમ તેની ભાષા ઉપર ધ્યાન હેવું પડશે. જ્યાં સુધી મૂલ અંથકર્તાના વિચાર અવિ.

“ “વીર” વર્ષ ૨ જું અંક ૧૧-૧૨ હિંદિ લેખનો અનુવાદ. દિંહિમાં પત્રિકા રૂપે પ્રકાશક શ્રીમાન બાણુ સાહેબ પૂરણુંદળ નદાર કલકત્તા,

કલ રૂપથી સર્વ સાધારણુમાં ન પ્રચારિત થાય ત્યાં સુધી તે અથને ખરે-ખરો પ્રચાર થયો તેમ સમજવું નહિં, પરંતુ તે ત્યારે જ બની શકે છે કે જ્યારે સંપાદક મૂળ અંથકારનો આશય સારી રીતે સમજ પોતે તે કામ હાથમાં લે. અમે એમ સારી રીતે સમજથી છીયે કે પ્રચલિત ભાષા પાંચ પાંચ યા હશ હશ અથવા સો સો ગાડ હુર કોઈને કોઈ રીતે બદલાયેલી પ્રતીત થાય છે. \* \* જુઓ ! કાશીરથી પાંચ પાંચ અથવા હશ હશ ગાડ પ્રતિદિન ચાલતા બંગાલમાં પહેંચીયે તો બંગ ભાષા શીખ્યા વિના પણ સમજમાં આવશે. સંયુક્ત પ્રાંતની ભાષા પંનથમાં બિહાર સમતા રહ્યે છે, બિહારની ભાષામાં બંગલાનો રંગ ચડતો લાગે છે, મિથિલામાં રહેતા બંગાલ પહેંચે તે પંનથી બંગલા થઈ જય છે અને ત્યાંથી પંનથ જય તો પંનથી ભાષા થઈ જય છે.

જે સન્જન કોઈ ભાષાના પ્રાચીન સાહિત્યના મર્મજ્ઞ થવા ધ્યાચ્છતા હોય તો તેમને આવશ્યક છે કે પ્રથમ તે ભાષાના વર્તમાન રૂપનો યથેષ્ટ પરિચય કરી કુમશઃ આગળ ચાલે. જેમકે શ્રી હેમચંદ્રાચાર્યના પ્રાકૃત બ્યાકરણનું પુરું જ્ઞાન થાય તે પહેલાં વર્તમાન સમયના કોઈ પ્રાકૃત બ્યાકરણ અંથો હોય તે જેમણું કુમવાર આગળના અંથતું જ્ઞાન મેળવે જય; અને તેમના સમય પછીના જયાં સુધી એની અંથો જણતા જય તે સર્વ જોતાં ત્યાં સુધી વધતો જય તો તે પુરુષ બ્યાકરણનો મર્મ જણુવામાં ઘણ્ણીજ ચોછી ઠઠીનતા થશે.

એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવા પછી આપણે ટીકા, રિખપણીદ્વારા ચથાવત મૂળ અંથ કર્તાના મનોભાવને શુદ્ધ સ્વરૂપમાં અન્ય વિક્ષનોની સમક્ષ સુકવાને સમર્થ થઈ શકીશું. કદાપિ તે જ્ઞાનાચ છલંગ મારી પ્રાચીન સાહિત્ય સંપાદન કરવા આપણે એસીશું તો અગણિત ઠોકરો આવી પડશે, એટલું જ નહિં પરંતુ આપણે અદ્ધાર્પૂર્વક એમ નહિં કણી શકીશું કે અમારા અર્થ નિસંદેહ અંથકારના ભાવ ચથાવત્ત પ્રકાશ કરનારા છે ! તેટલા માટે અંથ સંપાદન કાર્યને માટે પ્રથમ ભાષાનું જ્ઞાન અત્યાવશ્યક છે, તે જ્ઞાનથી સંપાદકેના લેખોની ભૂલો સુલેખોના અક્ષરોની ભરોડો, અને એની વ્યક્તિગત અલિર્દ્યા અને ભાવોનું સૌંદર્ય સંપૂર્ણ રૂપથી પ્રતીત થશે.

થીજું અંથ નિર્વાચનનું કાર્ય પણ કરીન છે. કયા કયા જીણોદ્વાર અંથોને પ્રચાર પ્રથમ થવો આવશ્યક છે, તે અંથ કયા વિષયનો છે, તે કેવોં જુનો પુરાણો છે, તેના સંપાદન કાર્યમાં કોણું સમર્થ છે કે જેને તે સાંપવામાં આવે ? એટલી ભાષતો આમાં વિચારણીય છે.

અમારા જણુવા સુજબ દાર્શનિક, અને વैજ્ઞાનિક અંથોની રક્ષા સર્વોપરિ

## संपादकतुं कर्तव्य.

२१

छे; परंतु ते गमे ते मनुष्यना हाथथी तेने माटे न्याय भणी शके तेवो ते विषय नथी, जेथी उपर्नी आणत उपर ध्यान आपवामां जे न आवे तो ते कार्य माटे वापरेली शक्ति अने पैसा व्यर्थ जशे.

आचीन नैन साहित्यना निर्वाचन पर तेनुं संपादन कार्य सर्वथा निर्भर छे. आज लाल ते कार्यमां डोळ प्रकाशने नियम, डोळ जातनी शूभ्रता (संकलना) अने डोळ विषय विभागने विचारपूर्ण रूपथी करवामां आवतो नथी. अमोने आज तक पुरेपुरे भतो भण्यो नथी के अमारा दर्शनमां डेटला व्याकरणे छे ? डेटला डोष छे ? अने तेमां पण डोने प्रथम संपादन करवो उचित छे ? पुस्तकेना निर्वाचन, संपादन, आथवा प्रकाशनमां कांधने कांध उद्देश, सिद्धांत डोळ निश्चित अभीष्ट अवश्य होवुं जेठ्ये परंतु अमारे त्यां तेवुं कांध पण्य नथी. एक पुस्तकने एक अंश या एक लाग छपाये होय, तो आडीना लागनी खबर पण लेवामां आवती नथी.

एक वभते देशमां छापभाना नहोता अने पुस्तक लभाववा अने प्रकाशन कराववानी बहुज डिनिता होती, परंतु ज्यारथी छापवानी प्रथा भारतमां शहू थाई त्यारथी आपणी डिनिता फूट थाई; परंतु हिंगीरी साथे कडेलुं पडे छे के आपणा नैन बांधुओचे छापानो लाल एटलो बघो लीघो नथी के अन्य हिन्दू भाइये जेटलो लीघो होय ? छापभानाने धतिहास अमे जेठ्ये छीये तो आजे सवासो वर्ष थयां हिंदमां छापवानुं काम चाले छे. सौथी पडेलुं ४० स० १७६२ मां बंगालमां बंगला टाईपमां संकृत अंथ छपाये होतो. नैनधर्मनुं सौथी प्रथम पुस्तक जे मारा जेवामां आवेल छे ते ४० स० १८६८ मां छपायेल, परंतु अनेकवार आपणी अनुहारता अने अंध विश्वासथी आपणे संसारमां समुन्नत थतां हजलो आधाओ नाखीये छीये. डेटलाक महाशयो छापवानी विरुद्ध छे, डेटलाक वेणित पुस्तकेनी सूचिना संशोधन थी विरुद्ध होय छे, अने डेटलाक तो शण्हो अलग अलग कापी लभावाने अने स्थापित करवा चिन्हे अने विरामो देवाय ते माटे पण अणुगमो घतावे छे. ते गमे तेम होय परंतु अमारो धराहो मात्र संसार साथे चालवानो नहि परंतु आपणा धर्मथांथा, साहित्य लंडार अने आपणा प्राचीन जैरवने सुरक्षित राखवानो छे. महत् कार्यी माटे महत् उद्योग करवो जेठ्ये.

डोळ पण्य अंथ तेना कर्ताना हाथे प्रकट थतां जे जौरव होय ते करतां अधिक गुण जौरववाणो अने तेवी आवश्यकता होवी जेठ्ये, के तेना आपणे सुपुत्र उत्तराधिकारीनी घेठे सारी रीते समावेशना, उपयुक्त वीका, ट्रिपणी सहित सावधानी पूर्वक प्रकाशित करीये. डेटले प्रकारे पातला, भोटा अक्षरे

अने जड़रीयात छेय त्यां लाल, पीला रंगना संडेतोनो व्यवहार प्राचीन काणथी याव्यो आवे छे ते नियम पछु संपादकोंचे पूर्ण ध्यानमां राखवे नेइचे. तेमज थील राते थंथने सुभोधक, सर्वाग्रिय, अने सभय अव्याववावाणो करवा माटे प्रकाशित करती वर्खते थंथनी आवश्यकीय सूचिमां दाखल कर्वी ते पछु संपादकनुं प्रधान कर्विय छे.

बाणुवा प्रभाषे सुर्शिहाबाह निवासी रायबाहाहुर धनपतिसिंहज्ञाचे धाणुं ज ४०्य अरचीने जैन आगमो, थंथो संपादित करवी प्रकाशित कर्या, परंतु अमारे कर्वेलुं पडे छे के ते पुस्तकेमां रहेल अशुद्धिचोना कारण्युथी विकानोमां यथाचेण्य सन्मानित न थयां जेथी तेना माटे श्रद्धेय डॉक्टर हॉर्नल साहेबे नीचे प्रभाषे जाणुवे छे.

" As an edition it is worthless, being made with no regard whatsoever to textual or grammatical correctness, both in its Sanskrit and Prakrit Portions. " ( Upasakadasha Bibliotheca India Series, Introduction Page XI, Calcutta 1890.

आवृत्ति तरिके ते नकारातुं छे; उभे वस्तुनी अथवा व्याकरणुनी सुधारणा संस्कृत तथा प्राकृत भागमां थध नथी. (उपासकदशांग, थील्हीजोथीका ठिकाया सीरीज इन्डोइंडियन प्रातुं ११ कलकत्ता १८६०)

ते केवल असावधानीतुं इण छे. तेटला माटे उपर्युक्त विषयोपर ध्यान राखी संपादन कार्य सहा यैर्यता राखीने कर्वेलुं नेइचे.

बंगालनी प्रसिद्ध एशीयाईक सोसायटी तरक्की डॉक्टर हॉर्नले श्री उपासक दशांग, नामने आगम थंथ सातुवाह संस्करणु प्रकाशित करेल छे, ते अमारा जेवामां आव्यो छे ते थंथना मुकाबलामां लास्तवर्षमां प्रकाशित थयेल केआध पछु थंथ आव्यो नथी. ते थंथ संपूर्ण आवश्यकीय टीका, टिप्पणी आव्यो अने सूचियो सहित शुद्ध संस्करणु छे. हालमां अमेरीकामां हार्टल साहेबे पूर्णभास्र गणि कृत पंचतंत्रतुं एक संस्करणु संपादित करेल छे, ते कार्यमां लगभग ६० हस्तलिपित पुस्तको घण्टीज भेणते हर हर देशोथी एकनित करीने भूमा साथे एक एक अक्षरे भेणवी तैयार करेल छे. उपासक पाठांतरे अने कथाचोना हेर हेर खावाथी ते पर सतर्क वाहानुवाह करेल छे. भूत्वातुं परिशोधन अने उपर्युक्त प्रस्तावना अने परिशिष्टेद्वारा थंथने विस्तृष्टि त करवातुं काम तेतुंज छे एम तेमां जेवायेल छे. एटला आंतरिक गुणे छावा छां आह्य इपपर पछु एाछुं ध्यान आपेल नथी. अमोऱ्ये आजसुधी एटलुं सुंदर संस्करणु केआध पछु देशी पुस्तकेमां देण्युं नथी, जेथी अमो

## એક પ્રાચીન ઐતિહાસિક પત્ર.

૨૩

નિશ્ચય પૂર્વક ઠહીયે છીયે કે સંપાદન કાર્ય ઉપર્યુક્ત પ્રકારે આદર્શરૂપ થવાથી તે થંથ પ્રાચીન હો કે નવીન હો પરંતુ સમસ્ત સંસારમાં સુધોગ્ય સંપાદનના બળથી નિસંદેહ સંચાહિત થશે.

આટલા ઉપરથી પાડકગણે એમ ન સમજુ લેવું કે એમે ડેવળ આપણી કોમમાં થતાં સંપાદન કાર્યની તુટીયો લખીએ છીએ, પરંતુ અમારા જોવામાં આજ તક પ્રકાશિત થયેલા અમૂહ્ય થંથાના સંસ્કરણોનું બરાણર રમરણ છે. તે જોઈ ને લખું છું: હાલમાં આપણું જૈન શૈવતાંત્ર સિદ્ધાંત થંથાના પ્રકાશન કાર્યો ઉત્તનારી સંસ્થાઓએ પ્રકાશન કરેલા થંથો પ્રશાસનીય છે, તેમજ દિગંભર જૈન સિદ્ધાંત થંથો પ્રકાશ કર્તનારી સંસ્થાઓનું પ્રકાશન પણ તેવું જ છે. તેમજ ગાયકવાડ સરકાર તરફથી પ્રગટ થતી ઓરીયેન્ટલ સીરીઝમાંથી પણ ઉત્તમ થંથો પ્રકટ થયા છે. તે સિવાય હિન્દુાંડ, અમેરિકા, ક્રાંસ, જર્મની, ઇટાલી, નેર્વી, આહિ સ્થાનેમાં અનૈન વિદ્યાનો તેને કાંઈ મૂળ, અનુવાહ, ટીકા, ટિપ્પણી સાથે થંથો પ્રકટ કરેલ છે તે સર્વ માટે જૈન સમાજ આલારી છે. આટલું થંથ પ્રકાશન માટે જણાવી બનેલે વિષય સામયિક પત્રોના સંપાદકનું શું કાર્ય છે તે હવે પછી બતાવીશું.

( ચાલુ )

## એક ઐતિહાસિક પત્ર.

નેધપુરના શ્રી સંઘે વિજ્યહેવેદ્રસૂરિ ઉપર પાડવેલો પત્ર.

જે સં. ૧૮૬૨ ની સાલનો છે.

૧૦ બોંગીલાલ સંઉસરા-પાટણ.

જેધપુરના સંઘે સં. ૧૮૬૨ માં તપાગચ્છાધિરાજ લ૦ શ્રી વિજ્યહેવેન્દ્રસૂરિ ઉપર એક વિજ્ઞપ્તિપત્ર<sup>૧</sup> મોકલ્યું હતું તેની હાથપત્ર પ્ર૦ શ્રી કાન્તિવિજ્યજી મહારાજ પાસેથી મને મળ્યા હતી. તે પત્ર જેશના ગીપણાની ચેઠે એક લાંઘ લુંગળાના આકારમાં છે. પોણો ભાગ તો ચિન્તાથીજ રોકાયેલો છે. આકીના ભાગમાં સુન્દર ગૂજરાતી પદમાં વિજ્ઞપ્તિ લખેલી છે. અંતમાં સંધનો પત્ર લખેલો. વિજ્ઞાપ્ત બધી સુન્દર દેવનાગરી અક્ષરશમાં છે, અને પત્ર માચાડી હણની ચુન્દરાતી લખિમાં લખેલો છે.

પત્રમાં પ્રથમ આચાર્યના ચુણેનું વણ્ણન કર્યું છે અને પછી જેધપુરમાં થયેલા ધર્મકૃત્યોનું વર્ણન ચુન્દરાતી અને મારવાઈની બેળસેળવાળી ભાષામાં કરેલું છે.

આચાર્ય આ વખતે સુરતમાં વિરાજમાન હતા.

૧ દરેક આવકને 'વિજ્ઞપ્તિ પત્ર' નો અર્થ જણ્ણું છે.

## સૂળ પત્ર.

સ્વચ્છિતશ્રી પાસજિનં<sup>૧</sup> અણુગ્રય શ્રી સુરત બિંદર સુભસથાંને સકલ ગુણુનિ-  
દ્યાન એક વિધ અસંજમરા ટાળણુહાર, હવિધ ધરમ ગ્રાંથક, તિન તત્ત્વરા જાંણ,  
ચ્યાર કથાય જીપક, પંચમહાવત પાલક, અટકાયરક્ષક, સાતથય નિવારક, આઠમ-  
દયુરક, નવવિધ અન્ધાયારજના પાલક, દસવિધ જતિ ધરમ ધારક, દ્યુષોર અંગના  
જાંણ, બારે ઉપંગના વખાણુ, તેરે કાઠિયાજીપક, સતરે સેન સંજમપાલણુહાર, અડારે  
સહસ સીલંગરથ ધારક, ઉગણીસ જાતા અદ્યયનરા પ્રદ્યપક, વિસ થાનક તથ આરા-  
ધક, ધકીસ ગુણ આવક જાંણ, બાવિસ પદિસહ જીપક, ધત્યાહિ છતીસ સ્વર્ગ ગુણૈ  
કરિ વિરાજમાંન, અનેક ઔપમા વિરાજમાંન, પરમાપૂર્ણ, સકલસહારક પુરંદર,  
લદ્દારકજી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રીવિન્દેહેવેદ્રસૂરીશ્વરજી ચરણાનુ કમલાયન  
શ્રી ક્લેંચ્પુર થા. સહાસેવક આગ્યાકારી, સમસથ<sup>૨</sup> સંઘ લિખતાં વંદણા ૧૦૮  
વાર અવધારસી.

અઠારા સમાચાર શ્રીજીલરી કીર્તા કર લલા છે, આપરા સહા સરવહા આરોગ્ય  
ચાહીનૈ, સહા સેવકાં ઉપર કૃપા-અનુશ્રદ્ધ કુરમાવે જિણુસૂ વિસેષ કુરમાવસી, અપ્રંચ<sup>૩</sup>  
અઠ ચૌમાસૈ પુન્યાસ યં, શ્રીમતુ ઇપનિજેજીને મેલાયા સૂ વડા નોંધ ગીતારથ છે,  
પાઠીયે વ્યાખ્યાન શ્રી ઉત્તરાધેનજી ઉપાધ્યાય ભાવવિજેજી કૃત વચિને છે, સિઝાય  
શ્રી સમવાયાંગ સૂત્રત્રી હુંવે છે, ઓરણહિ ગઢી-પરગચ્છિ શ્રાવક-શ્રાવિકા પેસે-પડિ-  
કમણૈ ધણા આવે છે. વખાણુ-પયખાંણ, ધરમ-દ્યાનરી વધીતર<sup>૪</sup> આછી રીત  
હુંવે છે. ઔર હમરકે<sup>૫</sup> શ્રી પર્જ્ઞસણા પ્રથમૈ બેલાતેલા, અઠાઈ, સ્વામિવિઘ્ન  
પ્રલાવના, ચોસા, પડિકમણા ધણા આડંભરસું હુંવે છે શ્રી જિન મિંદરે પૂજ  
અષ્ટ પ્રકારી, સતરે લેદી, નવપદજીરી, થીજા હી ધર્મકૃત્ય આડંભરસું સુખે  
થયા છે, સૂ પુન્યાનજીરી વાણું સ્નાનને શ્રીસંઘ ધણું પ્રસન છે. પુન્યાસજીરે  
ચેલા પીળુ વાંચણુ, લણુણુ, ગણુણુ મૈ વિસેસ સાવધાન છે.....ઔર સંઘરે  
આપરા દરસણુરી જાહા ઉમેદ છે, સૂ કીર્તા કર અઠી પદ્ધારણું કમે (?) સૂ  
કરાવસી, ( લખિતંગ ) સુ સિંઘ હિશ્રી જીને વાંદે<sup>૬</sup> ઔર ડામકાજ કેચેસૂ કૃપા  
કરને લિખાવસી આપને વાંદસે જિણુ હિન (તિ હિન) વડી, આણું હુસી કૃપા  
પતર<sup>૭</sup> હિરાવસી સંવત ૧૮૬૨ રા મહા સુહ ય ॥ લંડારી સિરહાર મલરી  
વનણા અવધારસી લલવાંણી બાલયંદરી વનણા એકસો આઠવાર અવધારસી.

૧ પાર્શ્વજિનં. ૨ સમસ્ત. ૩ સં. અપરં ચ. પદ્ધારામાં. ૪ વધારે. ૫ 'હમારા'  
એવા અર્થ હશે? ૬ જિન વાંદે. ૭ પત્ર. ૮ વંહના.

“ संस्कारित भन ” ( भननी विशुद्धि ) .

२५

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ  
 ॐ “ संस्कारित भन ” ( भननी विशुद्धि ) ॐ  
 ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ



आ

शणहोनो भावार्थ ऐवा हे के शुद्धतर विचारेथी तथा धर्मिक भावनाच्याथी धडाचेलुं भन ते संस्कारित भन. हरेक धर्ममां भनेयेगने संस्कार अनाववा माटे धरेलुं ज भक्तव अपालुं हे.

“ श्रीभान् आनंदधनलु भग्नाराज ” श्री उंचुनाथ प्रभुनुं स्तपन करतां कडे हे के “ भन साध्युं तेणु सध्युं साध्युं, ऐह वात नहि ऐटी ” आ शणहो अहु भनन करवा जेवा हे.

कियाच्या अनेकवार कर्या छतां लुव उत्त्वस्थितिनो अनुकूव करतो नथी, अवन हुःअद्य लाज्या करे हे, तेनुं सुख्य कारणु भननी विशुद्धतानो असाव हे. भनने अज्ञासथी यातो योग, ध्यान विगेरे अनेक कियाथी ऐवुं विशुद्ध अने संस्कारी अनावी हेवुं नेहाए के गमे तेवा संयोगी प्राप्त थता ज्ञापणु संकल्प-विकल्पयुक्त न थाय, विकारीलावोनी धुमस ज्ञापणु तेने न आगाणी शके, गमे तेवा निमित्तो प्राप्त थतां पणु ज्ञापणु क्षमाभावथी प्रकृतिमां विकृति न उत्पन्न थाय. आवुं संस्कारी भन अनाववानो अडुर्निंश प्रयत्न करवो नेहाए. शास्त्रकार कडे हे के—

जं अज्जिजञ्च चरित्तं देसुणाएत्र पुव्वकोडीए ॥

तं पुण कसायमित्तो हारेहनरो मुहुत्तेण ॥

हेये उष्णा पूर्व कोड वर्ष सुधी चारित्र यागवाथी के चारित्र शुष्णु उपार्जन कर्या होय तेने एक सुहृत्तमान डपाय करवाथी प्राणी हारी जाय हे.

भननी विशुद्धि वगर करेली धर्मकियाच्या शुष्ठे हे, ज्यारे विशुद्धि पूर्वक करेली यांची पणु किया धरेला ज विशिष्ट कृणने आपनारी हे.

काया अने वयननी शुद्धि करतां भननी शुद्धि उपर विशेष भक्तव अताव्युं हे. आपणुमां दृष्टान्त हे के—

प्रसन्नयंद्र राज्ञि संसार त्याग करी दीक्षा अहेणु करी राजगुही नगरीना उद्घानमां काउसण्यमां उला हे, पडेहेज भग्नावीर प्रभुनुं समोवसरणु हेठी श्रेष्ठीक भग्नाराज सप्तरिवार वांदवा आव्या हे, तेमांथी ऐ योद्धानी दृष्टि ते प्रसन्नयंद्र राज्ञि उपर पडी, तेमां एक सेष्ठाए तेमनी ध्यान विगेरेनी प्रशंसा करी

૨૬

## શ્રી આત્માનંદ પ્રકાશ.

ત્યારે હુસુખ નામનો હૃષ્ટ સ્વભાવી યોગ્યો બોલ્યો કે આતે પાપી છે, કારણું જેણે નહાની ઉમરના છોકરાને સુધી દીક્ષા લીધી પણ તેનો હુશમન તેના રાજ્ય ઉપર ચડી આવી તેના મંત્રીઓને ખુટબી છોકરાને મારી તેનું રાન્ય પડાવી લેશે, આ જવાખારી આને શિર છે. આવું વાક્ય સાંભળતાં તે પ્રસન્નચંદ્ર રાજ્યિંતું મન ચુદ્ધમાં પરોવાઈ ગયું. સંકલ્પ, વિકલ્પ, તર્ક, વિતર્ક, સાથે શત્રુને રહાત કરવા માટે માનસિક યોગથી સૈન્ય તૈયાર કરવા માંહયું અને અનુકૂળે ચુદ્ધ શરૂ કર્યું.

આ વખતે પ્રસન્નચંદ્ર રાજ્યિંતે જેચેતા હોવાથી શ્રેષ્ઠીક મહારાજાએ મહા-વીર પ્રભુને પ્રક્ષે કર્યો કે, પ્રસન્નચંદ્ર રાજ્યિંત્ર અત્યારે આયુષ્યનો બંધ કરે તો કયાં જાય ? પ્રભુએ પહેલી નરકે જાય એમ કહ્યું, ત્યાર પછી શ્રેષ્ઠીક મહા-રાજાએ પૂછ્યાં અનુકૂળે જે અત્યારે આયુષ્યનો બંધ કરે તો સાતમી નારકીએ જાય એમ કહ્યું. અહીં તે રાજ્યિંત્ર અનુકૂળે માનસિક મેદાનમાં લડતા લડતા તેમના ભાથમાંનાં તીર ખુરી જવાથી ભાથનો સુકુટ ઈંકપાના ધરાદાથી ભાથે હાથ સુંઠવા જતાં સુંઠને બદલે લોચ કરેલ મસ્તક જાણાયું; ત્યાં મનોવૃત્તિ ફરે છે, શુદ્ધ ધ્યાન ઉપર આર્દ્ધ થાય છે. વિચાર કરે છે કે મેં સાધુ થઈ મન વચ્ચન અને કાયથી કંઈ પણ પાય નહિં કરવાના પચ્ચાળાણ લીધાં છે. મેં આ શું હુષ્ટ્ય કર્યું ? આવી રીતે પચ્ચાતાપ કરતા, શુદ્ધ શ્રેષ્ઠીએ ચઢતા ચઢતાં નરકના દળીયા ઉડાડી દીધા. અહીં શ્રેષ્ઠીક મહારાજાએ પ્રભુને પૂછ્યું કે અત્યારે આયુષ્યનો બંધ કરે તો કયાં જાય પ્રભુએ કહ્યું કે શુલ્ષ ગતિનું આયુષ્ય બાંધે પણ શુલ્ષ ભાવનાના બણો અનુકૂળે સર્વાર્થસિદ્ધ વિમાનનું આયુષ્ય બાંધે એમ કહ્યું—કયાં સાતમી નર્ક અને કયાં સર્વાર્થસિદ્ધનું વિમાન. એક ઘડીમાં આટલું બધું પરિવર્તન ! મહાવીર પ્રભુએ કહ્યું કે હે શ્રેષ્ઠીક ! આ બધું મનના અદ્યવસાયનું કારણ છે એટલું જ નહિં પણ ને, આ દેવતાઓ તે રાજ્યિંત્રને ડેવળજ્ઞાનને મહોત્ત્સું કરવા જાય છે. આટલી વારમાં તો તેમણે ચારે ધનધાતીકર્મીને ખપાવી દીધા અને ડેવળજ્ઞાન અને ડેવળદર્શન ઉત્પત્ત કર્યા. આથી મન ઉપર ભાર સુકૃતાં શાસ્કડારોએ કહ્યું છે કે—

**મન એવ મનુષ્યાણાં કારણ બંધમોક્ષયો:**

આ માટે ખરાખ વાસના અને હૃષ્ટ સંકલ્પ વિકલ્પોથી હુંમેશાં મનનો રોધ કરવો.

સત્કિયામાં મનને તદ્વીન કરવા માટે અજ્ઞાસ પાડવો. કેમકે—અનેક સંસારી સુઝોમાં મન એમ આપણી પાસેથી કામ કે છે, તેમ ધાર્મિક દરેક

“ संस्कारित भन ” ( भननी विशुद्धि ).

۲۹

કિયાએ કરતાં મનને કહેવું કે અહીં તલ્લીન થઈ જ. એકાથ અને સ્થિર થા. કારણ કે અનેક સંસારિક કાર્યો કરાવી આત્માને હુંખમાં તેજ મુકેદો છે. આવી રીતે અભ્યાસથી તથા વૈરાગ્યથી મનને સંકારી બનાવવું મનની જેટલે અશે અશુદ્ધ હશે તેટલે અશે ચોગળી અશુદ્ધ થતાં કર્મની વૃદ્ધિ (આશ્રમ) નો બંધ થશે એટલા માટે જેમ અને તેમ મનને સંકારી બનાવવું.

પાતંજલ યોગશાસ્ત્રમાં પણ કદ્યું છે કે-અભ્યાસ વૈરાગ્યાભ્યાં તન્ત્રિરોધઃ અભ્યાસ અને વૈરાગ્યથી મનની વૃત્તિઓનો નિરોધ થાય છે.

મારે મનને પ્રભુતું દ્યાન કરવાનું મંહિર ગણી તેમાં જે હુષ વાસના-  
રૂપ કચરો હોય તેને સારુ કરી નાખ્યો અને પછી જે સામાયિક પ્રતિક્રમણા,  
કે પ્રભુપૂજા, આદિ જે ધર્મકિયાએ થશે તે અમૃતકિયાએ થશે અને અમૃત-  
તુદ્ય રૂપ આપશે. એ નિસ્સનદેહ છે.

ઉપાધ્યાણ શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે કે—“જાય લગે આવે નહિ મન ઠામ, તથ લગ કુદ કિયા સવિ નિષ્ફળ, જ્યોં ગગને ચિત્રામ. એ વાક્યો વિચારી-મનને સાહ્ય કરવા માટે પ્રભાળ પુરુષાર્થ કરી ઉત્ત્ય માનવબસ્તુ સાર્થક કરવો એજ આપણું પરમ ધેય છે.

દે--કસ્તુર્યાંદ હેમચાંદ હેશાઈ.  
ધાર્મિક શિક્ષક-જૈન ગુરુકુળ-પાલીતાણ.

# સ્વીકાર અને સમાલોચના.

શ્રી વીરનિર્વાણ સંવત ઔર કૈનકાલ-ગણુના—વેખક વિદ્ધાર્ય મુનિરાજ શ્રી કદ્યાષુવિજયજી ભણારાજ પ્રકાશક ક૦૦ વિ૦ શાસ્ત્ર સમિતિ-જાલોએ ( મારવાડ ) મૂલ્ય ઓછ રૂપ્યે. હિંદુભાગનો આ કેળ અને કૈનેતર જે અંથેનો આધાર લઈ તેના પ્રમાણા અને સટ્ટિપણ સાથે કૈન ઐતિહાસિક સાહિત્યની દર્શિયે મુનિરાજ શ્રી કદ્યાષુવિજયજી ભણારાજે વિદ્તાપૂર્ણ રીતે લખ્યો છે. ધતિહાસ સાહિત્યમાં રસ કેતાં કૈન અને કૈનેતર સાક્ષરે, વિદ્ધાને અને ધતિહાસ રસિકો માટે તે વાચવા વિચારવા અને મનન કરવા જરૂરો છે. આ નિષ્ઠાંધ લખવાથી વેખક મુનિરાજશ્રીએ ધતિહાસ સાહિત્યમાં ઔર વધારો ઝોરો છે તેટલું ન નહિં પરંતુ સુલ્ય પારશ્રમ ઉદ્ઘાટ્યો છે.

પ્રાચીન ધર્મિકાસ સંશોધનના કાર્યમાં જૈન સાહિત્ય ધર્મજ પ્રાચીન છતાં તેનો વિશેષ પ્રચાર અને ઉપયોગ થયો નથી, પરંતુ અન્ય સાક્ષરેતનું તે પ્રતિ હાલમાં ધ્યાન એંચાયું છે જે યોગ્ય છે. જૈન પ્રાચીન સાહિત્ય ડેટલું પ્રાચીન છે. તેની પ્રતીતિ ઉપ-

રોકિત નિખંધ વાંચવાથી થશે એમ અમારું માનવું છે. આ નિખંધમાં ગૌતમસુદ્ધ અને શ્રી ભગ્વાનીર દેવના સમય કાળનો નિર્ણય કરવામાં પ્રખ્યાત રાજત્વકાલ ગણનાનો તેમજ મુગપ્રધાનો, આચાર્યો, સ્થવિરોની કાલગણનાનો ઉપયોગ તેમજ તે વખતના બનાવોની હકીકિત પણ સાથે આપેલ હેવાથી ધતિહાસિક બાબતો સાથે બીજુ ડેટલીક નવી નવી હકીકતો વાચકને જાણવાની પણ તેમાંથી મળે છે. એકંદર રીતે આણો લેખ મનન કરવા જેવો, અમૃત્યુ અને ઔતિહાસિક દિષ્ટિઓ ધર્ણો સુંદર લખ્યો છે, સર્વતે વાચવાની સુચના કરીએ છીએ.

જૈન ગૂજર્ઝ કવિઓ-ધીજો ભાગ-પ્રોજેક્ટ મોહનલાલ હલીયંહ દેશાધ, પ્રકાશક શ્રી જૈન શ્રેષ્ઠ કોન્ફરન્સ ઓફિસ-મુંબઈ. કિંમત રૂપીયા ત્રણ. આ ધીજી ભાગમાં વિકેનના અદારમા શતકના ગુજરાતી ભાષાના જૈનકવિઓની કૃતિઓ સદિત વિરતત સૂચિ આપવામાં આવેલ છે. બાધ મોહનલાલ જૈન સાહિત્ય ધતિહાસના ખરેખરા અભ્યાસી અને સંશોધક છે. જૈન વરતીવાળા, જૈન ભાંડારોવાળા શહેરોમાં જઈ ખંતપૂર્વક કરેલ શાધ અને પ્રયત્નનું ઇળ આ અંથનું પ્રકાશન તે છે; કે જે તેમના નિવેદનમાં વાંચાથી જાણ્યાય છે. આ અંથમાં કવિઓની અનુક્રમણિકા અને છેવેટે ગઘકૃતિઓની નોંધ કરી ચાર અનુક્રમણિકા આપેલ છે જેથી ડેઢપણુ હકીકિત મેળવતાં વાચકને સરલતા થાય છે તે પણી પાંચ પરિશિષ્ટો જૈનકથા નામકાષ, જૈન ગચ્છેની ગુરુપદ્ધાવલીએ ! વ્રીજનમાં અંચલ ગચ્છની પદ્ધાવલી, ચોથા રાજવલી અને છેવેટે પ્રથમ અંથના અભિપ્રાયો છે. ચાર પચીશીમાં આખા શતકના જૈન કવિઓની કૃતિના વહેંચણી કરવામાં આવે છે, જેથી સંકલનપૂર્વક યથાયોગ્ય આ અંથની રચના વિદ્ધતાપૂર્ણ બંધુ મોહનલાલે કરી છે. આ અંથ પ્રકટ થવાથી શ્રી જૈન કોન્ફરન્સ સાહિત્ય માટે જે પ્રયાસો કરે છે તેમાં આ અંથ તેની વૃદ્ધિ કરે છે; એટલું જ નહિં પરંતુ ગુજરાતના સર્વમાન્ય ધતિહાસના લેખક ને ઉપયોગી વસ્તુ થઈ પડી છે. જૈન અને જૈનેતર ધતિહાસપ્રિય વાંચકોએ આ અંથનો લાલ લેવા જેવું છે.

સુતનિપાત અનુવાદક અદ્યાપક વર્મનંહ કેસન્થી, પ્રકટ કર્તા શ્રી ગુજરાત વિદ્યાપીક, અમદાવાદ શ્રીપુંજલાધ જૈન અંથમાળાના પ્રથમ અંથ તરીકે પ્રકટ કરેલ છે. આ જૈન અંથ માળામાં જૈન અંથો પ્રકટ કરવાના છતાં તેની શરૂઆત આ બૌદ્ધધર્મના અંથથી થાય છે. શેષ પુંજલાધની ધર્મા અદિસાની પોષક ડેઢ પણુ ધર્મના અંથો હોય તેનો પણ સ્વીકાર થવાની હોવાથીજ આ અંથ પ્રકાશકે પ્રકટ કરેલ જાણ્યાય છે. અનુવાદક ભગ્વાન્ય બૌદ્ધધર્મના વિકાન પંડિત સાક્ષર મુર્દુ હોવાથી યથાયોગ્ય થયેલ હોય તેમાં નવાઈ નથી. પાલીનિપિટકના સુત્ર, વિનય અને અભિધધર્મપિટક ત્રણ મુજબ વિભાગ છે. સુતપિટકના પાંચ વિભાગ દીધનિકાય, મન્જુઝમનિકાય, સંચુતનિકાય, અંગુતરનિકાય, અને મુહનિકાય એ છે; દ્વારે છેક્ષા નિકાયના પંદર પ્રકરણોમાં પાંચમા સુતનિપાતનો આ અનુવાદ છે, જેમાં આ સુતનિકાય બધા કરતા પ્રાચીન છે જુદા જુદ ૭૧ પ્રકરણોમાં ૧૧૪૬ ઉપયોગી ભોધવચનેતોનો સમાવેશ કરવામાં આવેલો છે. જૈન અને જૈનેતરને વાંચવાની અમો ભલામણુ કરીએ છીએ. કિંમત રૂ. ૧-૦-૦.

ખ્રીઓનું કદમ્પવૃક્ષ યાને જીવન રક્ષાનો રાજ્યવૈદ્ય.  
એટલે

# મહીલા મહોદય.

( ભાગ ૧ માં આવેદાં ચિત્રો પૈઢી એક નમુનો )



ગાયકવાડ  
સરકાર, સુલાઈ  
સરકાર, જુનાગઢ,  
ગોડલ, વિગર  
રાજ્યોના કેળ-  
વણીભાતાને

લાયઘેરી તથા  
છનામાંમાટેમાં-  
જીર કરેલ છે  
તે અંથની ઉ-  
પયોગીતા એ-  
તાવે છે.

પ્રકાશક:—‘જૈન’ ઓફિસ—ભાવનગર.

# મુહીલા-મુહેદ્ય

ભાગ ૧-૨ દરેક વરમાં જોઇશે.

—: કેમાં :—

જીવન જીવવાની કળા—

આહાર-અહાર, ખાન-પાન, રહેણી-કરણીના અનુભવને અભાવે અકાળે કરમાઈ જતાં જીવનને નવપત્રવિત કરી દીર્ઘાયુ જીવવાની કળા આ અથમાં તમે જોશો.

સંતાન સિદ્ધિનો અમતકાર—

ગર્ભ ન રહેવાના કારણેનું સંશોધન કરીને ગર્ભસ્થાનના દર્દીની ચિકિત્સા તથા તેને હુર કરવાના પ્રયોગો (ક્ષેત્ર શુદ્ધિ) તેમજ પુર્ણેના ઋતુદાનને અંગેના દોષો તથા તેના ઉપયારો (ધીજક શુદ્ધિ) તેની સંપૂર્ણ હકીકત સાથે મહર્બિંઓથી આદેશાચેતા અપ્રગટ હસ્તલીખિત તાડપત્રો આદિમાંથી સંશોધન કરીને લેખકે ખાસક વર્ણના લેખધારા અનુભવ પછી ધરગતું ઉપયારો આપેલા છે; તેમજ શક્તિ, તેજ માટે સેંકડોના લોગે મળતી શુદ્ધિકાચો, તૈલો, યાકૃતિએના સહજ-સુલભ વાળુકરણું પ્રયોગો પણ આ અથમાં સ્પષ્ટ અને વિસ્તારથી જોશો.

સુવાવડીનો સાથી—

ગર્ભ ઉછેર તથા પ્રસંગનું સંરક્ષણ જીવવાના અભાવે અનેક ડુગીને ઉલ્લભી થતી જ્ઞેનો જીવન જોધ એસે છે. અથવા તો સુડાલ-નિઃસત્વ બની જાય છે. તેમને આ પ્રકરણ આશિર્વાદરૂપ થઈ પડશે. કેમકે તેમાં ગર્ભ રહે ત્યારથી ગર્ભઉછેર અને ગર્ભવતીના આરોગ્ય માટે જરૂરી દરેક હકીકતો, તેમજ સુવાવડી અને સુયાણી (દાયા) માટે જરૂરી જીણી-મોટી સમજીતીનો સમાવેશ કર્યો છે. તેમજ ગર્ભમાં અને જરૂર પછી ખાળડોના પોથણું-રક્ષણું તેમજ વિકાસને લગતું વિસ્તૃત માર્ગદર્શન આ પ્રકરણમાં તમે જોશો.

આ અથ માટે મળોલ અભિઆય પૈડી કેલ્યાફઃ—

+++ જ્યારથી પહેલો લાગ પ્રકટ થયો ત્યારથી તેના વાંચેડાને ઉત્કંઠા રહેલી હતી કે કયારે ખીને લાગ પ્રકટ થાય ? +++ પહેલા લાગમાં નિરોગી રહેવા માટે એવાં તત્વો સમર્પવામાં આવ્યાં છે કે-ખીનાં વધુ તત્વો માટે મોહ રહી જાય. + + + (ખીન લાગમાં) અનેક રોગો, કારણો અને તેના ધરગથ્યું પુષ્કળ તુરખાએ આપેલા છે. + + + ડોક્ટરોની રી અને દ્વામાં પ્સા ખર્ચવાની જેમની શક્તિ ન હોય તેવા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ પુરસ્તક અતિ ઉપયોગી થઈ પડે તેમ છે.

“શુજરાતી પંચ” —અમદાવાદ.

\* \* \* \* \*  
અનેક દર્દીનાં લક્ષ્ણો અને તે ટાળવાના ઉપાય, આયુધવૃદ્ધિના નિયમો વગેરે સરસ, સુંદર અને સર્વોચ્ચ ભાષામાં વર્ણનેલ છે. આ પુરસ્તકમાં દશવિશ નિયમોનો અમલ કરવામાં આવે તો (ખીઓ) તાં દુરસ્તી સહેલાઈથી સાચ્ચાની શકે, વૈચ ડોક્ટરોની ભાગ્યેજ આવશ્યકતા રહે. + + + દરેક ગૃહસ્થોએ ગોતાના ધરમાં આ પુરસ્તક ખાસ સંગ્રહ કરવા ચોગ્ય છે. + + + આવાં પુરસ્તકો પ્રકટ થવાથી ખીઓ ગોતાની શારીરિક અને માનસિક રિથ્તિ સુધારવા ઉપરાંત પોતાનાં ખાળડોની માવજત પ્રત્યે સંપૂર્ણ લક્ષ દોરવી લખિણી સંતતિને તાં દુરસ્ત અને દીર્ઘાયુષી જીવવાના પ્રેરાશે. “હિતેચુ” કરાંચી.

\* \* \* \* \*  
+++ આ પુરસ્તક ખીજીવનનાં આધાર તરીકે અતિ ઉપયોગી છે. + + + અમે ન્યાયથી કંલીએ છીએ કે-હાલનાં વખતમાં એક નારીએ સનારી બનવાને આ પુરસ્તક એક સુંદર સહાય સમાન છે. + + + દરેક કુદુંબની દરેક દરેક ખીઓએ આવા પુરસ્તકોનો નિરંતર અભ્યાસ કરવો ઉચ્ચિત છે. ખીઓના સર્વ ધર્મ આ પુરસ્તકમાં ભરપુર છે.

“દેશીમિત્ર” —સુરત.

કીંમતઃ—ભાગ ૧ લો. તથા ખીનો દરેકની કીંમત રૂ. બધીયો. પોસ્ટ ખર્ચ દરેકના છ જ્યાના. એક સાથે બધીને ભાગ મંગાવવાર માટે પોષ ખર્ચ માઝે.



# મહીલામહોદ્ય ભાગ ૧ લામાં શું જોશો ? ( સચિત્ર )

## પ્રથમ પરિચ્છેદ.

- ૧ બાળકન.
- ૨ પુખ્ત ગલાશય.
- ૩ ઋતુવંતીના ધર્મ.
- ૪ ઋતુસનાન પણીનો વિધિ.
- ૫ શયન ચિકિત્સા.
- ૬ પુત્રનું પુત્ર પેહા કરવાની વિધ.
- ૭ નક્ષત્ર વિચાર.
- ૮ આહાર વિહાર.
- ૯ સ્વચ્છતાની સંતતી ઇણ ઉપર અસર.
- ૧૦ માનસિક ભાવનાનો પ્રભાવ.
- ૧૧ ગર્ભ ડેળવણી.
- ૧૨ પુત્ર અને પુત્રિમાં સમાનતા.
- ૧૩ ગર્ભ રહ્યો છે કે કેમ ? તેની પરીક્ષા.
- ૧૪ ગર્ભમાં પુત્ર છે કે પુત્ર તે જાણવાની રીત.
- ૧૫ ગલીશીએ પાળવાના નિયમો.
- ૧૬ સોળ સંસ્કાર.
- ૧૭ ગર્ભધાન સંસ્કાર વિધિ.
- ૧૮ પુંસવન સંસ્કાર વિધિ.
- ૧૯ પ્રસુતિ પાળવાના નિયમો.
- ૨૦ ગર્ભવંતીના હર્દી અને તેના ઉપાયો.
- ૨૧ પ્રસ્તુત સમય જાણવાનાં લંઘણું.

૨૨ સુવાવડીને માટે કેવું મકાન જોઈએ ?

૨૩ વંશુ લાવવાના ઉપાય.

૨૪ પ્રસ્તુત સમયની વ્યાધિએ અને તેના ઉપાય.

૨૫ એસર ન પડતી હોય તો તેના ઉપાય.

૨૬ જન્મ સંસ્કાર વિધિ.

૨૭ ગળથુથી.

૨૮ સુવાવડીનો જોરાક.

૨૯ પ્રસ્તુત શૂળનો ઉપાય.

૩૦ હાય્યીંડિક કવાથ.

૩૧ ચંદ્ર દર્શન વિધિ.

૩૨ નહુણું વિધિ.

૩૩ ક્ષિરાસન સંસ્કાર વિધિ.

૩૪ પણી પૂજન સંસ્કાર.

૩૫ નામાધિકરણ સંસ્કાર.

૩૬ સુંદીપાક ( કાટલું )

૩૭ બાળકને શી રીતે ઉછેરવાં ?

## દ્વિતીય પરિચ્છેદ.

૩૮ સંતતિ સંરક્ષણું.

૩૯ સબળ સંતતિ ઉત્પન્ન થવાનો સમય.

૪૦ ધાવણું પરિક્ષા.

૪૧ ભાડુતી ધાવ.

૪૨ ગાય કે બકરીના હંધનું સેવન.

૪૩ ઠેમ.

૪૪ સ્તાનપાનનો સમય.

૪૫ ધાવણું વધારવાનો ઉપાય.

૪૬ અળ્લણુંનો ઉપાય.

૪૭ બાળકને બલિષ્ટ કેમ બનાવવું.

૪૮ અન્નપ્રાશન સંસ્કાર વિધિ.

૪૯ જોરાક શાર્ડ કરવાની આગાહી.

૫૦ બાળકનો શરૂઆતનો જોરાક.

૫૧ બાળકને નહુવરાવવાનું ધોરણું.

૫૨ બાળકના અંગોની અલિવણી.

૫૩ સ્વચ્છ હુવાનો પરિચય.

૫૪ કસરત.

૫૫ બાળકના દોહીની શિતાનું માપ.

૫૬ રહેવાનું મકાન કેવું જોઈએ.

૫૭ બાળકને કેટલી ઉધ જરૂરની છે.

૫૮ બાળકને કપડાં કેવાં પહેરાવવાં.

૫૯ બાળકને ચાલતાં શી રીતે શીખવવું ?

૬૦ દાંત કુટટી વખતે રાખવાની કાવજતા.

૬૧ બાળકને ખાલતાં શી રીતે શીખવવું ?

૬૨ બાળકની સાથે માણા-પોણો જ વર્તવું ?

૬૩ ભાગાપ એ ભાગકના  
વર્તમાન શુરૂ છે.  
૬૪ સેખત તેવી અસર.  
૬૫ તમાકુનો જેરી મહિમા.  
૬૬ તમાકુનો હિંમાં પ્રવેશ.  
૬૭ ભાગડો અને દાળિના.  
૬૮ ભાગઅંજન.  
૬૯ ભાગાગોળી.  
૭૦ ભાગકને અળીયાશીળી  
કદાવવા.  
૭૧ ભાગડોને પ્રાથમિક  
શિક્ષણ.  
૭૨ ભાગશિક્ષણમાં રાણ-  
વાની સંભાળ.  
૭૩ ભાગકના રોગ પાર-  
ખવાની રીત.  
૭૪ ભાગકના આસ રોગો.  
૭૫ ભાગરોગો માટે ઔષધી.  
૭૬ દવાતું પ્રમાણુ.  
૭૭ કણ્ઠવૈધ સંસ્કાર.  
૭૮ કેશવપન સંસ્કાર.  
૭૯ ઉપનયન સંસ્કાર.  
૮૦ વિધારંભ સંસ્કાર.  
૮૧ શિક્ષણમાં માતાના સં-  
કલ્પ અળની અસર.

## તૃતીય પરિચ્છેદ.

૮૨ પુત્રિ શિક્ષણ.  
૮૩ માતાના વીરત્વતું ફરા.  
૮૪ શિક્ષિત સીનેા ગૃહ-  
સંસાર.

## ચતુર્થ પરિચ્છેદ.

૮૫ પ્રાચિન સતીઓનું  
શિક્ષણીય જીવન.  
૮૬ કૌશલયા.  
૮૭ સીતા.  
૮૮ સુમિત્રા.  
૮૯ જરતકા.

૯૦ ઉલ્લય ભારતી.  
૯૧ લીલાવતી.  
૯૨ હૈપ્ટી.  
૯૩ ગાંધારી.  
૯૪ મહાલસા.  
૯૫ દમથંતી.  
૯૬ મંહોદરી.  
૯૭ તારામતી.  
૯૮ મેનાવતી.  
૯૯ કર્મદેવી.  
૧૦૦ તારાણાઈ.  
૧૦૧ પદ્માવતી.  
૧૦૨ પ્રતાપરાણુની પર્ણી.  
૧૦૩ ચારુમતી.  
૧૦૪ મીરાંખાઈ.  
૧૦૫ હર્ગાવતી.  
૧૦૬ અહુલ્યાખાઈ.  
૧૦૭ વેળુખાઈ.  
૧૦૮ રાણીચંદા.  
૧૦૯ શ્રીમતીંહરદેવી.  
૧૧૦ કહાનદેવી.  
૧૧૧ પરમેશ્વરી જેવી.  
૧૧૨ રધુરાજ કુમારી.  
૧૧૩ સરદા દેવી.  
૧૧૪ અજાન સ્ત્રીઓનું  
વર્તન.

પંચમ પરિચ્છેદ.

૧૧૫ લભ ડેવડી ઉમરથી  
નેડવાં.  
૧૧૬ ડેવા વરને કન્યા પર-  
ણાવવી નેધર્યે.  
૧૧૭ સ્ત્રી પોતે સાસરે જતાં  
ધ્યાનમાં લેવા યોગ્ય  
નિયમો.  
૧૧૮ પતિ પ્રતેના ધર્મ  
માટે શાખોની આજા.  
૧૧૯ ધરેણું ડેવાં પહેરવાં.

કીંમત રૂ. એ પોસ્ટ ખર્ચ અલગ.

## ૫૪ પરિચ્છેદ.

૧૨૦ સતી સુલસા.  
૧૨૧ મદનરેખા.  
૧૨૨ દમથંતી.  
૧૨૩ સીતાણ.  
૧૨૪ સુભદ્રા.  
૧૨૫ અંજના સુંદરી.  
૧૨૬ શિવા સુંદરી.  
૧૨૭ દ્રૈપદી.  
૧૨૮ જ્યેષ્ઠા.  
૧૨૯ મૃગાવતી.  
૧૩૦ કલાવતી.  
૧૩૧ શીળવતી.  
૧૩૨ ઋષિદતા.  
૧૩૩ નંદયંતી.  
૧૩૪ રતિસુંદરી.  
૧૩૫ નર્મદા સુંદરી.  
૧૩૬ પ્રદ્યમાણા.

## સાતમ પરિચ્છેદ.

૧૩૭ પૂર્વી પુત્રીઓને અ-  
પાતું શિક્ષણ.  
૧૩૮ સ્ત્રીઓની ૬૪ કળા.  
૧૩૯ ભાગડીઓને ૭૩૨નું  
શિક્ષણ.  
૧૪૦ નિયમિતપણ.  
૧૪૧ માતૃપિતૃ લક્ષ્ણ.  
૧૪૨ વિધા અને વિનયતું  
શિક્ષણ.  
૧૪૩ બુદ્ધિ વિકાસ.  
૧૪૪ ભિતનસાર પ્રથા અને  
ગૃહ વ્યવસ્થા.  
૧૪૫ સ્ત્રીઓનું સામાન્ય  
ધર્મશાસ્ત્ર.  
૧૪૬ સામાન્ય નીતિસૂત્રો.  
૧૪૭ સ્ત્રીઓની હાલત સુ-  
ધારવા સંબંધી કેટ-  
લાક ઉપાયો.  
૧૪૮ સ્વદેશ પ્રેમની ગરણી.



# હિલામહોદ્ય ભાગ ૨ જમાં શું જોશો ?

પ્રથમ પરિચ્છેદ પ્રજોત્પત્તિ,  
અ ક્ષેત્રશુદ્ધિ વિભાગ.

- ૧ સંતતિનું મૃહ્ય.
- ૨ ગર્ભ ન રહેવાનાં કારણો.
- ૩ કમળનું ફરી જાણું.
- ૪ ખીંગોનાં સાત ચુમ દર્દી,  
તેનાં લક્ષ્યણો અને ઉપાયો.
- ૫ સલેમાન-હૃત્માના ઉપાય.
- ૬ આલી ગયેલું ખીને ગર્ભ  
રહેવાના ઉપાય.
- ૭ અદ્ભુતામિ ( અટકાવ. )
- ૮ ન્યુનાર્થવ.
- ૯ પીડિતાર્થવ.
- ૧૦ નન્ધાર્થવ.
- ૧૧ લોલીવા.
- ૧૨ પ્રદરના બેદ તથા ઉપાયો.
- ૧૩ મહનમોદક શુટિકાની દૃતિ.
- ૧૪ મેથીના લાડુ.
- ૧૫ મોતીની બરસ.
- ૧૬ સુંદરી સૌભાગ્યપાક.
- ૧૭ ધૂતિકળ.
- ૧૮ અદ્ભુતશુદ્ધિ.
- ૧૯ ગર્ભસાયનાં નિવિધ દર્દી દૂર  
કરી ગર્ભ રહેવાના ઉપાયો.
- ૨૦ દ્વારાધીની શક્તિ.
- ૨૧ મહનકળ.
- ૨૨ અંગુઠ અને પેટશળ.
- ૨૩ કુળાંતા પ્રયોગ.
- ૨૪ પીપળાનો પ્રયોગ.
- ૨૫ અશ્વગધાનો પ્રયોગ.
- ૨૬ ખાખરાનો પ્રયોગ.
- ૨૭ શિવલિંગાનો પ્રયોગ.
- ૨૮ ખીનેરાંનો પ્રયોગ.
- ૨૯ ઉપયારેનું પૃથ્વીરણ.
- ૩૦ મૂત્ર કે મુનિપ્રામિ.

## વ ભીજકશુદ્ધિ વિભાગ.

- ૩૧ સંતતિ ન થવાનાં કારણું  
આટે ખી-પુરુષની પરીક્ષા.
- ૩૨ દેહનો રાજુ.
- ૩૩ આળ લમે.
- ૩૪ ચા અને ડાઢી.
- ૩૫ તમાકુ.
- ૩૬ બ્યસનો છોઝવાના ઉપાય.
- ૩૭ બ્યસનાં શુટિકા.
- ૩૮ કુદરતી શક્તિનો ખણનો.
- ૩૯ ખાંડ કે ખુરું.
- ૪૦ સંચાનો લોટ.
- ૪૧ ફહેનોના મંદવાડ.
- ૪૨ જીવવાનો હકુ.
- ૪૩ દીવાયુષ જોગવનારાં મ-  
ગુષ્યો.
- ૪૪ આત્મહત્યા.
- ૪૫ વિચારની નબળાઈ.
- ૪૬ આયુષ કુમ દ્વારે છે ?
- ૪૭ ધાતુકીષુતા.
- ૪૮ ઉપવાસ.
- ૪૯ ધાતુપુષ્ટિ ( વીર્યવિદ્ધિ ) ના  
ઉપાયો.
- ૫૦ ધાતુપાષિક પાક.
- ૫૧ કામેદીપન અને વીય-  
સ્તંભન ઉપયારો.
- ૫૨ કામેદીપન શુટિકા.
- ૫૩ ધાતુસ્તંભન કુચકા.
- ૫૪ શાટોપયાર ( વાળુકરણ ).
- ૫૫ શાંદ્રાવનાશ લેપની દૃતિ.
- ૫૬ અમીરી ઉપયારો.
- ૫૭ મકરધ્વજ શુટિકાની દૃતિ.
- ૫૮ કામહેવ „ „
- ૫૯ યાડુતી.
- ૬૦ પ્રમહના બેદ અને ઉપયારો.
- ૬૧ ઉપરંશ ( ચાંદી-ટાંકી )  
અને તેના ઉપયાર.
- ૬૨ ઉપરંશમાં ખાવાના ઉપયાર.
- ૬૩ મલમના ઉપયારો.
- ૬૪ ધૂમ-ગર્ભ.
- ૬૫ પ્રસવ કાળ.
- ૬૬ રહેણીકરણી.
- ૬૭ પ્રસબના ચિન્હો.

६७ प्रस्तुतिगृह.  
 ६८ भेजथी थतुं तुक्षयान.  
 ६९ सूर्याणी.  
 १०० प्रसववेहना शह थवाना  
 चिन्हो.  
 १०१ छोकरं सीधुं छे के आड़  
 तेनी तपास.  
 १०२ गर्भ आडो क्यारे होय छे.  
 १०३ मुवेलो गर्भ.  
 १०४ प्रसवनी पहेली अवस्था.  
 १०५ जरायु.  
 १०६ प्रसवनी वीणा अवस्था.  
 १०७ „ वीणा अवस्था.  
 १०८ नाण.  
 १०९ प्रसवनो वेग.  
 ११० बाणको ज्ञवनश्वास.  
 १११ नाणछेहन.  
 ११२ ओरतो नीकाल.  
 ११३ जरायुनी व्यवस्था.

### तृतीय परिच्छेद-सुवाव० अने बाणउछर०

११४ नवो अवतार.  
 ११५ शांति.  
 ११६ शोक.  
 ११७ लोहिनो प्रवाह.  
 ११८ हवाथी रक्षण.  
 ११९ शरदी.  
 १२० खुली हवा.  
 १२१ शरीरशुद्धि.  
 १२२ आनपान.  
 १२३ भणशुद्धि.  
 १२४ पेटनो यडवो.  
 १२५ सुवा रोग.  
 १२६ देवदाराहि क्वाथ  
 १२७ पंचशुद्धि पाक  
 १२८ सौभाग्य सुंहीपाक  
 १२९ दशमूलाहि क्वाथ  
 १३० सूतिका रोगहर क्वाथ

१३१ लाडी थूर्णू.  
 १३२ सुलेमानी क्षार  
 १३३ सूतिका वातरोग.  
 १३४ योनी भांश.  
 १३५ गुल्मिंग प्रहेशदाह.  
 १३६ कमणुं छीरी जवुं.  
 १३७ योनी दृद्द.  
 १३८ योनीनां चांदां के हुभावो.  
 १३९ मञ्जुल रोग.  
 १४० योनी तंग  
 १४१ रतन रोग.  
 १४२ सोजन.  
 १४३ सूतिका सन्निपात.  
 १४४ मननी नयणाध.  
 १४५ हीरूया ( अपस्मार )  
 १४६ „ ना उपायो.  
 १४७ संयम.  
 १४८ गुण्हानी सज्ज.  
 १४९ महातानी इरज.  
 १५० बाणकतुं शिक्षण.  
 १५१ बाणजिग्रासा.  
 १५२ भिथ्या भयतुं छे.  
 १५३ शुद्धिनो विकास.  
 १५४ बाणउछर.  
 १५५ प्रसव पठीनी बाण-  
 संभाग.  
 १५६ अद्वीण. ( शरीर शुद्धि )  
 १५७ गणथुथी.  
 १५८ आराम.  
 १५९ धावण.  
 १६० रतनपान.  
 १६१ धावणुनी अरिक्षा अने  
 धावणु शुद्धि.  
 १६२ धावणुनी किमत.  
 १६३ धावमाता.  
 १६४ धावणुने अहले हुध  
 १६५ धावणुशुद्धिनो उपाय.  
 १६६ धावणुने हितकर जोराक  
 अने संभाग.  
 १६७ धावणुनी उलटी.  
 १६८ बाणकन धावतुं होय तो.

१६९ बाणकना दृद्दनी हवा.  
 १७० बाणकनो रोग ने भाताने  
 हवा.  
 १७१ हवानुं प्रभाण.  
 १७२ बाणयातुरबद्र.  
 १७३ बालाभूत.  
 १७४ सामान्य पौष्टिक उपाय.  
 १७५ छुमी ( करीम )  
 १७६ ताव.  
 १७७ लद मुक्ताहि क्वाथ.  
 १७८ उधरस.  
 १७९ मेली उधरस. ( कुडीया  
 भांसी )  
 १८० अंगाई ( ताण )  
 १८१ लराई जवुं.  
 १८२ घेयालनो अगाड.  
 १८३ मनवृद्धि.  
 १८४ उलटी.  
 १८५ आडो, भरडो तथा अतिस.  
 १८६ गणुं पडवुं ( बाणशोष )  
 १८७ बाणकतुं तवाई जवुं.  
 १८८ नाभीनो पाक.  
 १८९ युदा पाक.  
 १९० मोनो पाक.  
 १९१ खुजली ( चामडीना वि-  
 कारी )  
 १९२ जर्मनी होडलीओ.  
 १९३ कानना चासडा.  
 १९४ दांत कुटवा.  
 १९५ रतवा.  
 १९६ शीणस.  
 १९७ अच्छडा.  
 १९८ ओरी.  
 १९९ हांड.  
 २०० पारवलो.  
 २०१ मुखशुद्धि  
 २०२ आंझा  
 २०३ बाणकनो जोराक  
 २०४ पश्चिमनुं बाणरक्षण  
 २०५ प्रशीर्ण.  
 विग्रे विग्रे

कीमत रु. ए. पैसट भर्य अलग.

# ਐਤਿਹਾਸਿਕ ਨੋਵੇਲੀ.

॥ ਜੇ ਤਮਾਰੇ ॥

ਈਤਿਹਾਸਨੇ ਨਾਮੇ ਕਾਦਪ-  
ਨਿਕ ਪਾਤ੍ਰੇ ਉਭਾਂ ਕੰਢੀਨੇ ਮਨ-  
ਸ਼੍ਵੀ ਰੱਗੇਨਾ ਓਾਪ ਚਥਾਵੇਲਾਂ  
ਨੋਵੇਲੇਹਾਨੀ ਮਲੀਨ ਛਾਧਾਥੀ  
ਅਥੀ ਜਵੁਂ ਛੋਧ—

ਤੋ  
ਜ੍ਵਾਲ

ਛੇਕਾ ਏਕ ਹੁਨਰ ਵਰਣਨਾ  
ਤੇਜ਼ ਅਰਸਾਮਾਂ ਲਖਾਅੇਲ ਪ੍ਰ-  
ਮਾਣਿਕ ਈਤਿਹਾਸਨਾ ਆਧਾਰੇ  
ਰਚਾਅੇਲਾਂ ਨੀਚੇਨਾ ਨੋਵੇਲੇ  
ਵਾਂਚਵਾਂ ਜੋਧਾਏ.

## ਗੁਜਰਾਤਨੁੰ ਗੌਰਵ.

ਧਾਰੇ

ਵਿਮਲਮਂਤ੍ਰੀਨੇ ਵਿਜਿਤ.

ਧ. ਸ. ਨਾ ਅਗਿਆਰਮਾ ਸੈਕਾਮਾਂ ਗੁਜਰਾਤਨੀ ਆਖੂ ਛੇਕ ਸੰਧਿ ਅਨੇ ਮਾਣਵਾ ਸੁਧੀ ਝੇਖਾਂ  
ਵਨਾਰ ਲੀਭ ਆਣਥਾਵਣੀਨਾ ਸਮਯਨੀ ਆ। ਐਤਿਹਾਸਿਕ ਨਵਲਕਥਾ ਛੇ। ਜੇਮਾਂ ਵਿਮਲਮਂਤ੍ਰੀਨੇ  
ਸ਼ੋਧਾਅੰਦੇ ਈਤਿਹਾਸ ਜੇਤਾਂ ਗੁਜਰ੍ਗ ਪ੍ਰਯਾਸਨਾਂ ਸੁਧੀ ਸੱਤਾ। ਅਨੇ ਜਗ੃ਤਿਨੇਂ ਸਪਣ ਘਾਲ ਆਪੇ ਛੇ。  
ਪਾਂਡੁ ਪ੍ਰਤੀ ਪ੍ਰਤੀ, ਕਿ. ੩। ੨-੦-੦

॥

## ਆਰਮੀ ਸਹੀਨੁੰ ਗੁਜਰਾਤ.

ਧਾਰੇ

ਗੁਜਰ੍ਗੈਥਰ ਕੁਮਾਰਪਾਣ.

ਗੁਜਰਾਤਨੀ ਜਾਣਾਜਲਾਲੀਨੇ ਸੂਰ੍ਯ ਜਧਾਰੇ ਪ੍ਰੂ ਬਹਾਰਮਾਂ ਤਪੀ ਰਥਾ ਹੁਤੇ। ਤੇ ਸਮਧਨਾ  
ਸੱਤਾਵਾਰ ਈਤਿਹਾਸਨੇ ਆਧਾਰੇ ਆ ਨੋਵੇਲ ਲਖਾਵੁਂ ਛੇ। ਜੇਮਾਂ ਗੁਜਰ੍ਗ ਪ੍ਰਤਿ ਸਿਫਰਾਜ ਜਥਿਤਿਹਾਸਨਾ  
ਸਮਧਨੇ। ਈਤਿਹਾਸ, ਮਾਣਵਾ, ਯੁਦੇਲਾਅਂਡ, ਸੈਰਾਅਥ ਤੇਮਜ ਮਾਰਵਾਇਮਾਂ ਵਿਜਿਤ, ਪਟਖੂਆਹੁਂ  
ਪ੍ਰਾਧਾਨ੍ਯ ਵਗੇਰੇ ੧੫ ਪ੍ਰਕਰਣੋਂ ਕੁਝ ਗੁਜਰ੍ਗੈਥਰ ਕੁਮਾਰਪਾਣਨੇ। ਜੁਵਨ ਪਰਿਚਿਤ ਆਵੇ ਛੇ। ਜੇ  
ਕੰਮਲੀਲਾ ਅਨੇ ਚਡਤੀ ਪਤਤੀਨੇ। ਅਰੋ ਘਾਲ ਆਪਣੇ। ਆਵਡੇ ਫਣਦਾਰ ਥੰਥ ਅਨੇ ਪਾਂਡੁ  
ਆਹਨਿੰਦਿਂਗ ਛਤਾਂ ਕਿ. ੪-੦-੦

॥

## ਪਾਠਣੁਨੀ ਚਡਤੀ ਪਤਤੀ. (ਭਾਗ ੧-੨-੩)

ਧਾਰੇ ਵੀਰਸਿਰੋਮਣੀ ਵਸਤੁਪਾਣ.

ਤੇਰਮੀ ਸਹੀਨਾ ਪ੍ਰਾਂਕਮਾਂ ਫੀਲਈਨਾ ਚੌਡਾਣੋ, ਆਖੁਨਾ ਪਰਮਾਰੇ। ਵਗੇਰੇ ਛਿੰਦਨੀ ਰਾਜਪੁਤ-  
ਸੱਤਾਅੰਦੀ ਸਾਥੇਨੀ ਅਥਡਾਮਣੀਨੇ ਲਾਭ ਲਾਉ ਸੁਲਟੀਮ ਸੱਤਾਅੰਦੀ ਛਿੰਦਮਾ ਸ਼ਾਹੁ ਕਰੇਲੀ ਜਮਾਵਟ—  
ਲੋਣਾ ਲੀਮਟੇਵ ਨੀ ਲੋਣਾਅਥੀ ਅਣਹੀਲਪੁਰਨੀ ਆਪਤਿ—ਧਵਲਪੁਰ (ਬੋਣਕਾ) ਨਾ ਸੋਲਾਂਕੀ  
ਬਰਹਾਰ—ਵਾਧੇਲਾ—ਨੀਰਥਵਲਨੁੰ ਵੀਰਤਵ ਤਥਾ ਮਾਂਤ੍ਰੀ ਵਸਤੁਪਾਣ ਅਨੇ ਸੇਨਾਪਤਿ ਤੇਜ਼ਪ੍ਰਾਣਨਾਂ  
ਅਵਲੁਤ ਪਰਾਇਮੇਨੋ। ਈਤਿਹਾਸ ਆ ਨਵਲਕਥਾਮਾਂ ਏਵੇਂ ਤੋਂ ਸੜਚੋਟ ਅਨੇ ਸਤਿਪ੍ਰੰਤੂ ਵਣ੍ਣੁਂਧੇ। ਛੇ  
ਤੇ ਵਾਂਚਵੇਂ ਸ਼ਾਹੁ ਕਰਵਾ ਪਈ ਤਰ੍ਹੇ ਭਾਗ ਪੂਰਾ ਵਾਂਚਵਾ ਜੁ ਪੱਤੇਂ।

ਦੂਜੇ ਭਾਗਨੀ ਝੀਮਤ ਕਿ. ਅਣਥੇ। ਏਕ ਸਾਥੇ ਕਿ. ਕਿ. ੫-੦-੦

८

## मेवाडनो पुनर्द्धार.

याने

लाभ्यविधायक लाभाशाह.

मुगळ सतानी छायामां ज्यारे धीमे धीमे राजपूत तेज आँखुं पहवा लाग्युं हुतुं त्यारे  
मेवाडपति भाडाराणा प्रताप ना बाहुभणे राष्ट्र अने धर्मनुं रक्षणु केवी रीते कर्युं ? तेने  
शैर्यभर्यो धतिहास आ नोवेलमां आपतां लाभाशाहनी राष्ट्रभक्ति, अक्षरनी राजनीति  
वगेरे हड्किक्त जाणुने केआधपणु देशालिमानी लाई झेनना हीलमां राष्ट्रलावनानुं नवुं चैतन्य  
रेडाया विना रहेशो नहि.

किं. ढा. २-०-०

❖

## श्री शत्रुंजय प्रकाश.

नैन तिर्थ श्री शत्रुंजयनो पंदरसो वर्धनो सप्रभाणु धतिहास आ अंथमां छे. जे वांच-  
वाथी सामाज्ञक तिर्थो, अने तेनी महत्वपूर्ण पवित्रताना रक्षणु संभवै धणुं जाणुवानुं  
मण्हो. केआधपणु धर्मप्रेमी भाइओने धर्मरक्षा भाटे तिर्थ धतिहासनो अल्यास करवाने तक  
मणे भाटे किं. ढा. १-०-०

❖

## अर्पण,

रा. सुशीलना हाये नवा युगनी रसलरी शैवीमे लभायेदी वार्ताए।

उ जे अंथनी साक्षरो सुझाइ डे प्रशास्त्रा करी रह्या छे.

अन्टीक पेपर अने सुंदर गेटप. कीमत ढा. १-४-०

- |                            |                         |
|----------------------------|-------------------------|
| ( १ ) गौतमस्वामीनो शिष्य   | ( ६ ) आर्द्धकुमार       |
| ( २ ) निःशंक अक्षा         | ( ७ ) वात्सल्यघेली भाता |
| ( ३ ) कदम्पो नंदीभेणु      | ( ८ ) हरिकेशी अण        |
| ( ४ ) सदालपुत्रनो नियतिवाद | ( ९ ) अलक्ष्मीकुमार     |
| ( ५ ) हरिअग्नि भाधी        | ( १० ) भिथिलापति नभिराज |

—: हरेक पुस्तको मणवानुं स्थग :—

जैन पत्रनी ओर्डीस—लावनगर.

## કોને લખશો ?

પર્વાધિરાજ શ્રી પચુંખણું પર્વમાં લહાણી માટે જેઠતાં સસ્તાં અને સારાં પુસ્તકો માટે—તેમજ આતુર્માસમાં નિવૃત્તિમાં વાંચવા લાયક ધાર્મિક દ્વાતિહાસીક પુસ્તકો માટે એક વખત અમને લખી ખાત્રા કરશો.

કારણું—અમારાં પોતાનાં પ્રકાશનો ઉપરાંત દરેક જાણીતી જૈન સંસ્થા-આનાં-યુક્તસેવારોનાં પુસ્તકોને સારો સ્ટોક અમારે ત્યાં રહે છે અને તે ઉપરાંત જૈનેતર નોવેલોનો પણ પસંદ કરાયેદો સારો સ્ટોક રહે છે. વધુ જથું માટે અમારું લીસ્ટ મંગાવો અને જૈનપત્ર તેમજ આત્માનંદ પ્રકાશ માસિકમાં વહેં-ચાયેલ અમારું લીસ્ટ વાંચો—

જૈન સસ્તી વાંચનમાળા.  
પાલીતાણું (કાઠીયાવાડ)

### કલકત્તાવાળાના વિવિધ રંગોથી મનોહર ઝોટાયો.

નામ.	સાઇઝ.	કોઈમત.
શ્રી નેમનાથ સ્વામીના લમતો વરણોડો. ૧૫x૨૦	૧૫x૨૦	૦-૧૨-૦
શ્રી ભદ્રાનીર સ્વામીનું સમવસરણ તથા શ્રેષ્ઠિક રાજની સ્વારી.	"	૦-૧૨-૦
શ્રી કેસરિયાજ ભદ્રારાજ.	"	૦-૮-૦
શ્રી ચંદ્રઘુમના સોળ સ્વાન.	"	૦-૮-૦
શ્રી ત્રિશલા માતાના ચૌદ સ્વાન.	"	૦-૮-૦
શ્રી ગૌતમ સ્વામી.	"	૦-૮-૦
શ્રી સમેતશિખરજ સિદ્ધક્ષેત્ર	"	૦-૮-૦
શ્રી રાજગિનિ મિદ્ધક્ષેત્ર.	"	૦-૬-૦
શ્રી પાવાપુરીજ સિદ્ધક્ષેત્ર.	"	૦-૬-૦
શ્રી ગિરન.૨જ સિદ્ધક્ષેત્ર.	"	૦-૬-૦
શ્રી જીનદાન સ્ક્રિપ્ટ ( દાદા સાહેબ )	"	૦-૬-૦
જ લેખણ.	"	૦-૬-૦
મધુભિંદુ.	"	૦-૬-૦
શ્રી પાવાપુરીનું જલમંદિર.	૧૬x૧૨	૦-૪-૦
<b>ચિત્રશાળા પ્રેસ પુનાવાળાના ઝોટાયો.</b>		
શ્રી ભદ્રાનીર સ્વામી.	૧૫x૨૦	૦-૮-૦
શ્રી ગૌતમ સ્વામી ભદ્રારાજ.	"	૦-૮-૦
સમેતશિખર તીર્થ ચિત્રાવળી-સોનેરી બાઇન્ડિંગ સાથે.	૨-૮-૦	
જ લુદીપનો નક્શો. રંગીન. ૧૬x૨૨	૧૬x૨૨	૦-૬-૦
નવતરણના ૧૫૫ બેદનો નક્શો. રંગીન ૧૬x૧૧	૧૬x૧૧	૦-૨-૦
<b>મળવાતું સ્થળ, શ્રી જૈન આત્માનંદ સભા—ભાવનગર.</b>		

Reg. No. B. 431.

## શ્રી આત્માનંદ પ્રકાશ

દર માસની પૂર્ણિમાએ પ્રગટ થતું માસિક પત્ર.

પુ. ૨૯ સુ. વીર સં. ૨૪૫૭. આવષ્ય. આત્મ સં. ૩૩. અંક ૧ લે.

### કવિવર રવીન્દ્રનાથ ઠાકુર

—\*—

“ વિશ્વનાં સૈંહર્યમાન, પ્રલુબદ્ધિતનાં નિગ્રંથ સ્તોત્રો, તત્ત્વજ્ઞાનનો ગણન મધુર ભર્મ અને પ્રકૃતિ તથા માનવ હૃદયનાં સૂક્ષ્મ ભાવચિત્રો, માત્ર હિંદના જ નહિ પણ જગતકરના સાહિત્યમાં અમર કરનાર કવિવર રવીન્દ્રનાથ જેટલી જગતકીર્તિ, ગાંધીજીને ખાદ કરતાં, તેએ પણ હિંદીને વરી નથી. સુષ્ટિસમરસને મુક્તિદાતા થઈ પડે તેવો ભારતીય તત્ત્વજ્ઞાનનો રહસ્ય સંદેશ હુનિયાને સંભળાવનાર એ કવિ-પયગંભરતું નામ સંભળતાં આખા જગતનું શિર માન અને આદરથી ઝૂકે છે. ‘વિશ્વકર્મિ’નું જિરહ એમને અપાવીને એમની ગીતાંજલિએ ૧૯૧૩ માં નોવેલ ધનામ મેળાવ્યું એ આખી ચે સવા લાખ ડેસિયાની રકમ એમણે જગત આગળ શિક્ષણુનો નવો આદર્શ રન્ધુ કરવા શાંતિ-નિકેતનની પોતાની અભિનવ શાળા કાઢવા પાછળ ખર્ચી, જેને વિકસાવીને તેમાં વિશ્વભારતી વિદ્યાપીઠનું નવું અંગ ઉમેયું છે. કવિ, નવલકાર, નાટ્યકાર, નિષાંધકાર, ચિત્રકાર અને તત્ત્વચિંતક રવીન્દ્રનાથની તોંકે આવે એવો એક પણ સાહિત્ય સ્વામી આજ ભારતને સીમાડે નથી, જેણે એમના જેટલો માનવીને વિચાર-વિકાસ કર્યો હોય. જગતના ચ્યાકમાં પૂર્વની સંસ્કૃતિનો ઉજાજવલ ધ્વજ ઝરકતો કરનાર એ ભારતીય દધાની સિરોરમી જન્મ નયાંતી ગઈ આહમી મેને દિવસે ઉજવાઈ.”